

Super Visa/ Visitor to Canada Insurance



- Best Mortgage Rates
- 1st and 2nd Mortgages
- Life and Critical Illness Insurance
- RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

**Mukund Sheth**  
Financial Advisor  
www.pyramidfinancial.ca  
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations  
GTA East / GTA West ON LIC # 10530  
Investment | Insurance | Mortgages

પરદેશમાં દેશની મહેક એટલે



# સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING  
Investment In Real Estate Can Make Your Future Better...

**FOR SELLERS**

- Free Home Staging Consultation
- Professional Photography & Virtual Tour
- Attractive Advertising
- Social Media Marketing
- Customized Feature Sheet
- Weekly Open House
- Assist in Mortgage & Legal Services

**FOR BUYERS**

- Team of Strong Mortgage Brokers
- Team of Lawyers
- Professional Home Inspectors
- Step by Step Guidance Through out Buying Process

**AMIT SHAH**  
Sales Representative  
Dir: 647-995-5640  
amit4tshomes@gmail.com

**KOMAL SHAH**  
Sales Representative  
Dir: 647-624-5640  
komal4tshomes@gmail.com

Homekey236@gmail.com  
Web: www.amitshah.ca



FRIDAY, 09 SEPTEMBER, 2022 Vol. 19, No. 36 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

# બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન

10 દિવસ પછી અંતિમક્રિયા, 73 વર્ષે રાજા બનેલા રાણીના મોટા પુત્ર કિંગ ચાર્લ્સ તૃતીય તરીકે ઓળખાશે

**લંડન**  
બ્રિટન પર સૌથી લાંબો સમય ૭૦ વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-૨નું બાલ્મોરા

મહેલ ખાતે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોક્ટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. રાણી એલિઝાબેથ-દ્વિતીયે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન



સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ મહારાણીના

નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો. એલિઝાબેથ દ્વિતીયનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના રોજ લંડન ખાતે ૧૭ બુરટન સેન્ટમાં થયો હતો. નૌકાદળના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે તેમનાં લગ્ન થયા હતા. તેમને પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ ચાર સંતાનો હતા. મહારાણીના પતિ ફિલિપ માઉન્ટબેટનનું એપ્રિલ ૨૦૨૧માં ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. કિંગ જ્યોર્જ-છઠ્ઠાના નિધન પછી ૧૯૫૨માં એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના સિંહાસન પર બેઠાં હતાં.

**ABOWATH**  
REAL ESTATE GROUP

MAAZ ABOWATH  
BROKER  
416 893 4585

More Info on PAGE 2  
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

MORTGAGE ADVICE THAT COMES TO YOU

**Dhires Shah**  
Mobile Mortgage Advisor

For expert advice contact me today

**CIBC**

dhires.shah@cibc.com

Tel : 647-248-0246

**SUPER VISA INSURANCE**

Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*

\*conditions apply.... Ask NOW for a free quote..

**Sanjiv Puri**  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

**StarLife**  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

**Closing down sale !**

Japanese Sarees, UK Sweaters and much more at attractive prices.

Upto **80% off**



- \$1 each Blouse Piece + 3 for \$100 Gold Print Jacquard Sarees.
- 4 for \$100 Gold Print Sarees.
- 5 for \$100 UK Sweaters.
- 10 for \$100 Printed Georgette Sarees.
- 20 for \$100 Japanese Plain Suit Pcs

and many more specials...

**Biggest Sale Ever!** Just in Time for the festive season!

**Uma Sarees**

6270 Côte des Neiges, Montreal  
514-341-1394

Residential  
New Condos  
Investments  
Commercial

દુશામાં યાદ રાખશો

**Zakir Patel**  
Broker

Cell: 416-561-7973  
Office : 416-287-2222

**RE/MAX COMMUNITY**  
Realty Inc., Brokerage

Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email : patelzakir82@gmail.com

ઠેલવા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896** અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**

Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



સામાજિક કાર્યકર રમેશભાઈ વ્યાસનું સ્વદેશ પરિવારમાં હાર્દિક સ્વાગત

**રમેશભાઈ વ્યાસ**  
(ડાયરેક્ટર અને પબ્લિશર, સ્વદેશ)

સંપર્ક : +1 647-236-2061 (Whatsapp Number) Email :- rkvyas143@gmail.com



**સ્વદેશ**  
Leading Gujarati Newspaper

રાજપૂત સમાજના અગ્રણી પરેશકુમાર પેશ્વાનું સ્વદેશ પરિવારમાં હાર્દિક સ્વાગત

**પરેશકુમાર ચંપકભાઈ પેશ્વા**  
(ડાયરેક્ટર માર્કેટીંગ, સ્વદેશ)

(જાહેરખબર તથા પ્રેસનોટ આપવા માટે સંપર્ક કરો)

સંપર્ક : +1 416-302-4531, 647-792-3374 Email :- info@swadesh.news



**સ્વદેશ**  
Leading Gujarati Newspaper



## ટોરોન્ટોમાં ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવ સાથે વિસર્જન



ટોરોન્ટો : ગણેશોત્સવમાં ભક્તો પોતાની માનતા અને શ્રદ્ધાઅનુસાર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરે છે. કેનેડાના ટોરોન્ટોમાં વસતા હિંદુ સમુદાયના ભક્તોએ આ વર્ષે પણ

ગણેશજીની પ્રતિમાનું સ્થાપન યોજના દિવસે કરાવ્યું હતું. જે બાદ 3 અને પાંચ દિવસની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ અવસરે માઈકલ ડગ્લાસ ફોર્ડ (એમએમપી, ઓન્ટેરિયો

મીનિસ્ટર ઓફ સીટીઝનસીપ એન્ડ મલ્ટીકલ્ચરલિઝમ) તથા ગ્રેહામ મેકગ્રેગોર (પાર્લામેન્ટરી આસી. ટૂ ધ મીનીસ્ટર ઓફ સીટીઝનસીપ એન્ડ મલ્ટીકલ્ચરલિઝમ)એ ખાસ હાજરી આપી હતી.

## સાસ્કેચવાનમાં જૂથ અથડામણ થતાં 10નાં મોત: બે શકમંદની શોધખોળ

ઓટાવા

કેનેડાના સાસ્કેચવાન પ્રાંતમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને જૂથના લોકોએ એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોનાં મોત થવા સાથે 15 લોકોને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બે શંકાસ્પદ આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શકમંદોનાં નામ ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

છે. ઘાયલોની સંખ્યા વધી શકે છે. એવું અનુમાન છે કે, કેટલાક ઈજાગ્રસ્તો જાતે જ હોસ્પિટલ પહોંચ્યા હશે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, સાસ્કેચવાનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે, હુમલો શા કારણે થયો એ બાબતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. એવું લાગે છે કે, કેટલાક પીડિતો ઉપર શંકાસ્પદો દ્વારા જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ડેમન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસનને છેલ્લી વખત રેજીના શહેરમાં જોવામાં આવ્યા હતા.

## ઓન્ટેરિયોમાં નર્સ નોંધણીને ઝડપી બનાવવા નર્સિંગ કોલેજને મંજૂરી

ઓન્ટેરિયો

ઓન્ટેરિયોના આરોગ્ય પ્રધાને પ્રાંતની નર્સિંગ કોલેજને નિયમનકારી ફેરફારો સાથે આગળ વધવાનું કહ્યું છે. જે હજારો વધુ આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષિત નર્સોને વધુ ઝડપથી પ્રવાહમાં લાવી શકે છે. સિલ્વિયા જોન્સે ગયા મહિને ઓન્ટેરિયોની કોલેજ ઓફ નર્સિસને આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષિત વ્યાવસાયિકોની વધુ ઝડપથી નોંધણી કરવાની યોજના વિકસાવવા નિર્દેશ આપ્યો હતો. કારણ કે, સ્ટાફની અછતને કારણે સમગ્ર પ્રાંતમાં ઈમર્જન્સી વિભાગ બંધ થઈ ગયો છે.

કોલેજની દરખાસ્તોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશિક્ષિત નર્સોને

અસ્થાયી રૂપે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેણે ઓન્ટેરિયોમાં રહેતા લગભગ 5,300 નોન-પ્રેક્ટિસિંગ નર્સો માટે જો તેઓ ઈચ્છે તો કર્મચારીઓને પાછા ફરવાનું સરળ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જોન્સે કહ્યું છે કે, તે તરત જ નિયમોમાં સુધારાનો મુસદ્દો તૈયાર કરે. તેણીએ તેમને ધ કેનેડિયન પ્રેસ દ્વારા મેળવેલા પત્રમાં લખ્યું હતું કે, મારી અપેક્ષા છે કે, આ સુધારાઓને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો કોલેજ તરત જ આંતરરાષ્ટ્રીય રીતે શિક્ષિત નર્સો અને અન્ય અરજદારોની નોંધણી કરવાનું શરૂ કરશે અને તેઓ આ ફેરફારોથી લાભ મેળવશે.

## કેનેડામાં નોકરીની ખાલી જગ્યાઓ જૂનમાં નવી વિક્રમજનક ઉચાઈએ પહોંચી ગઈ

સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો, દેશભરમાં 32,200 જેટલી વધુ નોકરી ઉપલબ્ધ

ઓન્ટેરિયો

સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ તાજેતરમાં જૂન 2022 માટે પગારપત્રક રોજગાર, કમાણી અને કલાકો તથા નોકરીની ખાલી જગ્યાઓ અંગેનું તેનું માસિક અપડેટ બહાર પાડ્યું છે. આ અપડેટમાં જોબ વેકેન્સી પરથી જાણવા મળ્યું છે કે, કેનેડામાં આ વર્ષના મે મહિનામાં નોકરી માટે 10 લાખ જગ્યાઓ ખાલી હતી. કેનેડામાં નોકરીની ખાલી જગ્યાઓ છેલ્લા મહિનામાં (મે અને જૂન 2022 વચ્ચે) 3.2% વધી છે, જેમાં દેશભરમાં 32,200 જેટલી વધુ નોકરીઓ ઉપલબ્ધ છે. આ સતત ત્રણ મહિનાથી બની રહ્યું છે, જ્યાં કેનેડામાં નોકરીની ખાલી જગ્યાઓની કુલ સંખ્યા એક મિલિયનને વટાવી ગઈ છે. જૂનમાં નોકરીની ખાલી જગ્યાઓ દર 5.9%

ઉપર આવી ગયો હતો. જે ગયા વર્ષના જૂન મહિના કરતા 1% વધારે છે અને સપ્ટેમ્બર 2021ના ઉચા રેકોર્ડ સાથે મેળ ખાય છે. હેલ્થ કેર અને સામાજિક ક્ષેત્રમાં નોકરીની ખાલી જગ્યાઓ ગયા વર્ષના જૂન મહિના કરતા 40.8% વધી છે. બીજા શબ્દોમાં કહીએ તો, રોજગાર ક્ષેત્રે જૂનમાં 1,49,700 ભરેલી જગ્યાઓ હતી અને 6.3% નોકરીની ખાલી જગ્યા હતી, જે સમગ્ર દેશમાં નોકરીની ખાલી જગ્યાના કુલ દર કરતાં 0.4% વધારે છે. હેલ્થ કેર અને સામાજિક સહાયતા કરતાં વધુ ખરાબ, આવાસ અને ખાદ્ય ક્ષેત્રે જૂનમાં નોકરી માટે 1,71,700 જગ્યાઓ ખાલી પડી હતી, જે સ્ટેટિસ્ટિક્સ કેનેડાના મે મહિનાના અપડેટ પછી 6.6% અને દરવર્ષે 38.8%નો વધારો સૂચવતો હતો.

## બ્રામ્પટનમાં પથિક અને રૂયા શુક્લાના નિવાસ સ્થાને ઉજવાયો ગણેશોત્સવ

દરરોજ પ્રાતઃ કાળે પૂજન અને આરતી તથા સંધ્યા કાળે સમૂહ આરતી થઈ



બ્રામ્પટન

કેનેડામાં ટોરોન્ટો અને બ્રામ્પટનમાં ઘણાં ભારતીયો અને ગુજરાતીઓ સ્થાયી થયા છે. જેથી આ ઉજવણી થતી રહે છે. બ્રામ્પટનમાં સ્થાયી થયેલા યુવાનો પૈકી રૂયા અને પથિક શુક્લા પ્રતિ વર્ષ આ ઉજવણી પોતાના નિવાસસ્થાને શ્રદ્ધાપૂર્વક કરતા રહ્યા છે. વર્ષો વર્ષ ગણેશજીના શણગાર માટે વિવિધ વિષય (થીમ) આધારિત આયોજન થાય છે. અગાઉના વર્ષોમાં આ ઉજવણી માટે ચોકલેટ, રેઈન ફોરેસ્ટ, ફલાવર થીમ આધારિત શણગાર કરાયા હતા. આ વર્ષે આ ઉજવણી ગણેશજીનું સ્થાપન મયુરાસનમાં કરી પીકોક આધારિત શણગાર થયો હતો. આ શણગારમાં મુખ્યત્વે સ્વયં તૈયાર કરેલી સામગ્રીનો ઉપયોગ કરાયો હતો.

આ ઉજવણી દરમ્યાન પ્રાતઃ કાળે પૂજન અને આરતી તથા સંધ્યા કાળે સમૂહ આરતી થઈ હતી. જેમાં મિત્ર વર્તુળ, પત્રકારો અને રાજકીય આગેવાનોએ ઉત્સાહથી આ ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રથમ દિવસે સ્થાપના પછી પ્રસંગોચિત સૌ પ્રથમ શ્રી ગણેશના ભક્તોમાં ભારતના

કોન્સુલેટ જનરલ અપૂર્વા શ્રીવાસ્તવે ગણેશજીના દર્શન કર્યો હતો. તે સાથે કેનેડાના ફેડરલ મિનિસ્ટર કમલ ખેરા, પ્રોવિન્સીયલ મિનિસ્ટર રબમીત સરકારીયા, માઈકલ ફોર્ડ અને ચારમીન વિલીયમ્સની હાજરી નોંધપાત્ર રહી હતી.

આ ઉપરાંત કેનેડાના સંસદ સભ્ય મનીન્દર (બ્રેમ્પટન ઈસ્ટ), રૂબી સહોરા (બ્રેમ્પટન નોર્થ) અને ગારનેટ જીનીયસ (EDMONTON) જ્યારે MPP માં ટિપ્પક આનંદ અમનજયોત સંઘ, હરદીપ ગ્રેવાલ, ગ્રાહમ અને શેરીફએ હાજર રહી ગણેશજીના આર્શિવાદ લીધા હતા. બ્રામ્પટનના મેયર પેટ્રીક બ્રાઉન અને રીજીયોનલ કાઉન્સેલર ગુરૂપ્રિત ધીલ્લોન, રોવેના સંતોષ અને પોલ વિનેસેટ પણ ઉત્સવમાં સહભાગી થયા હતા.

છેલ્લાં ત્રણ વર્ષથી પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં લઈ રૂયા શુક્લા, ઈકો ફેન્ડલી (માટીની) ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરે અને ઘરઆંગણે વિસર્જન કરે છે. જે બાબતની પ્રોવિન્સિયલ મિનિસ્ટર માઈકલ ફોર્ડ તથા MPP ગ્રેહામ પ્રશંસા કરી હતી.

# THINKING OF BUYING, SELLING OR INVESTING?

## આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

### CALL 416 893 4585 TODAY!!!

**SUBHRO CHAKRABORTY**  
SALES REPRESENTATIVE

**SUDHIR PARMAR**  
SALES REPRESENTATIVE

Call us TODAY for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

**MOHAMMAD ABOWATH**  
SALES REPRESENTATIVE

**MAAZ ABOWATH**  
BROKER - TEAM LEADER

**IBRAHIM ABOWATH**  
SALES REPRESENTATIVE

## 416 893 4585

# ABOWATH

## REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

**RE/MAX**  
your Local REALTOR

**ABOWATH.COM**

#1 RE/MAX





## વ્યાજ દરમાં વધારો હાઉસિંગ માર્કેટમાં તીવ્ર મંદી નોતરશે

માર્ચમાં વ્યાજ દરો 0.25 ટકાના નીચા સ્તરેથી દૂર કરવાનું શરૂ થતાં જ ઘરની કિંમતો અને ઘરનું વેચાણ ઘટી ગયું

### ટોરોન્ટો

અર્થશાસ્ત્રીઓના મતે કેનેડાના રિયલ એસ્ટેટની મંદી વધુ ઘેરી બનવાની છે. કારણ કે ઉધારની વધતી કિંમત વધુ ખરીદદારોને બજારમાંથી બહાર ધકેલી દે છે. બુધવારે કેનેડામાં વ્યાજ દરમાં વધારો થયો હતો. જે 2.5 ટકાથી 3.25 ટકા સુધીનો રહ્યો હતો.

સેન્ટ્રલ બેંકે માર્ચમાં વ્યાજ દરો 0.25 ટકાના નીચા સ્તરેથી હટાવવાનું શરૂ કર્યું ત્યારથી

કેનેડામાં ઘરની કિંમતો અને ઘરનું વેચાણ ઘટી ગયું છે. રોયલ બેંક ઓફ કેનેડાના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી રોબર્ટ હોગે જણાવ્યું હતું કે, “અમે મંદીને વધુ તીવ્ર અને ફેલાતા જોઈ રહ્યા છીએ. કારણ કે ખરીદદારો ઊંચા ધિરાણ દરોની અસરની ખાતરી કરતી વખતે રાહ જુઓનો અભિગમ અપનાવે છે.” ટોરોન્ટો પ્રદેશમાં, ઘરની કિંમતનો સૂચકાંક માર્ચથી ઓગસ્ટ સુધીમાં લગભગ 16 ટકા ઘટ્યો હતો. જેમાં શહેરના

કેટલાક વિસ્તારોમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. હોગે જણાવ્યું હતું કે દેશના સૌથી મોંઘા રિયલ એસ્ટેટ બજારો, જેમાં ટોરોન્ટો ઉપનગરોનો સમાવેશ થાય છે, તેમની અયોગ્યતા અને તેમના અગાઉના આશ્ચર્યજનક ભાવ વધારાને કારણે ઘટાડા માટે સૌથી વધુ સંવેદનશીલ છે.

રોગચાળાના પ્રથમ બે વર્ષમાં શહેરની પૂર્વમાં, ડરહામ પ્રદેશમાં સામાન્ય ઘરની કિંમત લગભગ 90 ટકા વધી હતી. જ્યારે પશ્ચિમમાં હેલ્ટનમાં

કિંમતો લગભગ 70 ટકા વધી હતી.

સ્થાનિક રિયલ એસ્ટેટ બોર્ડના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ મહિનામાં ડરહામના સામાન્ય ઘરોની કિંમતમાં 21 ટકા અથવા \$ 249,300નો ઘટાડો થયો છે.

છેલ્લા છ મહિનામાં હેલ્ટનની કિંમતોમાં 23 ટકા અથવા \$ 337,700નો ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ઘરની કિંમતો નીચેની તરફ ચાલુ રહેશે.

### બેન્કમાર્ક વ્યાજ દરમાં ફરી 3.25%નો વધારો

ટોરોન્ટો : બેંક ઓફ કેનેડાએ બુધવારે તેના ટ્રેન્ડસેટિંગ વ્યાજ દરમાં ટકાવારીના ત્રણ ચતુર્થાંશનો વધારો કર્યો હતો. જે મધ્યસ્થ બેંક દ્વારા કુગાવા ઉપર લગામ લગાવવાના તેના મિશનમાં છેલ્લું પગલું છે. રોગચાળાના પ્રારંભિક દિવસોમાં અર્થતંત્રને ઉત્તેજિત કરવામાં મદદ કરવા માટે 2020માં તેના દરને શૂન્યની નજીક ઘટાડી દીધા પછી કેનેડાની સેન્ટ્રલ બેંક કુગાવાને ઘટાડવા માટે ધિરાણ દરો વધારવા માટે આક્રમક રીતે આગળ વધી છે. જે દાયકાઓમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. બેંકનો દર કેનેડિયન ઉપભોક્તા અને વ્યવસાયોને તેમની બેંકો પાસેથી મોરગેજ, લાઈન્સ ઓફ ક્રેડિટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ જેવી વસ્તુઓ ઉપર મેળવેલા દરોને અસર કરે છે.

### લોન લેનારાઓએ વધુ રકમ ચુકવવા મજબૂર બનવું પડશે

બેંક ઓફ મોન્ટ્રીયલના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, મધ્યસ્થ બેંકના માર્ગદર્શને તેમના મતને મજબૂત બનાવ્યું છે કે, રાષ્ટ્રીય ઘરની કિંમત સૂચકાંક વર્ષની શરૂઆતમાં ટોચથી 20 ટકા ઘટીને આવતા વર્ષે તળિયે આવી શકે છે. લેનારા ટૂંક સમયમાં વધુ વ્યાજ ચૂકવશે. તે માત્ર ક્યારેની બાબત છે. વેરિયેબલ રેટ મોરગેજના મોટાભાગના ધારકો પાસે સ્થિર માસિક ચૂકવણી હોય છે, પરંતુ તેઓ તરત જ મુદલની ચૂકવણી કરવાને બદલે વ્યાજ તરફ ઊંચા શેર જોશે. ફિક્સ-રેટ મોરગેજ ધરાવતા લોકો જ્યારે તેમને રિન્યૂ કરશે ત્યારે તેઓ માસિક વધુ રકમ ચૂકવશે. હોમ ઇક્વિટી લાઈન ઓફ ક્રેડિટ ધરાવતા મકાનમાલિકો તેમની લોન ઉપર તરત જ ઊંચા વ્યાજ દર ચૂકવશે. અને બદલામાં



આનો અર્થ એ છે કે, ઘર ખરીદનારાઓ તેટલો ખર્ચ કરી શકશે નહીં. મોરગેજ બ્રોકરેજ મેટ્રિક્સ મોરગેજ ંલોબલના ચીફ ઓપરેટિંગ ઓફિસર લૌરા માર્ટિને જણાવ્યું હતું કે, પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે તે ખાસ કરીને મુશ્કેલ હશે. આજના વ્યાજ દરમાં વધારો મોરગેજ સ્ટ્રેસ ટેસ્ટને વધુ કઠિન બનાવશે.

## સામાજિક કાર્યકર રમેશભાઈ વ્યાસ હવે ‘સ્વદેશ’ના મુદ્રક અને પ્રકાશક

નવસારીના રમેશભાઈ વ્યાસ અનેક સામાજિક સેવા સાથે સંકળાયેલા છે

### ટોરોન્ટો

મૂળ મહેસાણાના વતની અને વર્ષોથી દક્ષિણ ગુજરાતના નવસારીમાં સ્થાયી થયેલા અને સેવાભાવિ રમેશભાઈ વ્યાસ સામાજિક કાર્યકર છે. તેઓ નવસારી વિસ્તારની અનેક સામાજિક સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે. હાલ તેઓ અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ તથા 60 બેડની સુવિધાયુક્ત અસલાહ ચેરીટેબલ ટ્રસ્ટ - વેસ્માના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર નવસારી ઓરિન્જ હોસ્પિટલમાં તેઓ ડાયરેક્ટર



તરીકે સેવા બજાવી રહ્યા છે. જ્યારે વેસ્મા ખાતે હોટેલ ફૂડ એક્સપ્રેસનું સંચાલન તેઓ સફળતા પૂર્વક કરી રહ્યા છે. તેઓ છેલ્લા 20 વર્ષથી જમીન-બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા છે. રમેશભાઈ વ્યાસ હવે ડાયરેક્ટર અને પબ્લિશર તરીકે સ્વદેશ પરિવાર સાથે જોડાયા છે. રમેશભાઈ વ્યાસ અખબારના માધ્યમ થકી કેનેડામાં વસતા ગુજરાતી- ભારતીય સમુદાયને મદદરૂપ થવાની નેમ ધરાવે છે. સ્વદેશ પરિવાર તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત તેમનું સ્વાગત છે. (રમેશભાઈ વ્યાસ વોટ્સ એપ નંબર-+1 647-236-2061)

## રાજપૂત સમાજના અગ્રણી પરેશકુમાર પેશ્વા બન્યા ‘સ્વદેશ’ના માર્કેટીંગ ડાયરેક્ટર

### ટોરોન્ટો


મૂળ ઉગત - નવસારીના રહેવાસી પરેશકુમાર ચંપકભાઈ પેશ્વા સ્વદેશ પરિવારના માર્કેટીંગ ડાયરેક્ટર તરીકે જોડાયા છે. જેઓ કેનેડા રાજપૂત સમાજના વાર્ધસ પ્રેસિડન્ટ હોવા સાથે સામાજિક પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા રહે છે.



સાથે સંકળાયેલા છે. તેઓ કેનેડા પોસ્ટમાં છેલ્લા 13 વર્ષથી સેવા આપી રહ્યા છે. હવે પરેશકુમાર ચંપકભાઈ પેશ્વા કેનેડામાં પ્રસિદ્ધ થતાં ગુજરાતી અખબાર સ્વદેશમાં માર્કેટીંગ ડાયરેક્ટર તરીકે જોડાયા છે. જેમનું સ્વદેશ પરિવાર તરફથી સ્વાગત છે. (પરેશકુમાર ચંપકભાઈ પેશ્વા, મોબાઈલ નંબર : +1 416-302-4531, 647-792-3374.)

## વડાપ્રધાન મોદીના હસ્તે સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું ઉદઘાટન થયું

મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું



નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો વિભાગ ‘કર્તવ્ય પથ’નું ઉદઘાટન કર્યું છે. તે પહેલા PM મોદીએ તેમના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ સાંજે 7 વાગે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે ઈન્ડિયા ગેટના તમામ 10 રૂટ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય લીધો

હતો. આજથી લગભગ 3.20 કિલોમીટર લાંબો રાજપથ હવે નવા રૂપ અને નામ સાથે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે દેશે અંગ્રેજોના સમયથી ચાલતા સેંકડો કાયદાઓ બદલ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા હવે દેશના યુવાનોને વિદેશી ભાષાની મજબૂરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. ફરજનો માર્ગ એ માત્ર ઈટો અને પથ્થરોનો રસ્તો નથી. ભારતના લોકતાંત્રિક ભૂતકાળ અને સર્વકાલીન આદર્શોનો આ જીવંત માર્ગ છે.

**SUPER VISA MEDICAL INSURANCE** Up to 45% DISCOUNT with deductible

**VISITOR TO CANADA INSURANCE**

**LIFE INSURANCE**

**MORTGAGE /LINE OF CREDIT INSURANCE**

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 8.00	\$ 12.00	\$ 11.00	\$ 18.00	\$ 20.00	\$ 27.00
40 Yrs	\$ 11.00	\$ 15.00	\$ 14.00	\$ 21.00	\$ 25.00	\$ 36.00
50 Yrs	\$ 25.00	\$ 35.00	\$ 32.00	\$ 45.00	\$ 60.00	\$ 85.00
60 Yrs	\$ 60.00	\$ 80.00	\$ 107.00	\$ 150.00	\$ 190.00	\$ 236.00

Rates Quotes are Preferred Plus Non Smoker Term 10 With Medical Test & Rates are Subject to Change.

- NO MEDICAL TEST LIFE INSURANCE (ત્યાં સુધી કે તમને ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કેન્સર હોય અથવા બીજી કોઈ કંપની દ્વારા તમામ ઇન્સ્યોરન્સને ડિક્લાઈન કર્યું હોય) (up to age) **85**
- LIFE INSURANCE FOR REFUGEES, STUDENTS, KIDS, ON WORK PERMIT
- GURANTEED MONEY BACK (Life, Critical Illness & Disability Insurance)
- Corporate owned Life and Critical Insurance
- Key Person Insurance • RRSP • RESP • TFSA

**Davinder Singh Chawla**  
TOLL : 1866.623.0865

Call For HONEST ADVICE 416.320.4614

www.financialhuttpd.co Email : - Davindersinghfhl@gmail.com



તંત્રી સ્થાનેથી

# બ્રિટનના વડાપ્રધાન બનવાનું ઋષિ સુનાકનું સપનું રોળાયું

બ્રિટનમાં બોરિસ જોન્સનની વિદાય બાદ પીએમ પદની ચૂંટણી યોજાઈ. પીએમની રેસમાં ભારતીય મૂળના 42 વર્ષીય સુનાકે પણ ઝંપલાવ્યું, જેની ટક્કર બ્રિટનના વિદેશ



તંત્રી - સ્વદેશ

મંત્રી લિસ ટ્રસ સાથે થઈ. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 1 લાખ 60 હજારથી વધુ સભ્યોએ મતદાન કર્યું હતું. ટોરી નેતૃત્વની આ ચૂંટણીમાં લિસ ટ્રસને કુલ 81,326 વોટ મળ્યા છે. જ્યારે ઋષિ સુનાકને

60,399 વોટ મળ્યા હતા. મતલબ સુનાક આ ચૂંટણી 20,927 મતોથી હારી ગયા. લિસ ટ્રસ બ્રિટનની ત્રીજી મહિલા વડાપ્રધાન છે. અગાઉ માર્ગારેટ થેચર અને થેરેસા મે આ પદ પર રહી ચક્રવા છે. લિસ ટ્રસ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા છે. પાર્ટીના સભ્યોએ બોરિસ જોન્સનના અનુગામી તરીકે ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનાક અને વિદેશ પ્રધાન લિસ ટ્રસ વચ્ચે પસંદગી કરવાની હતી.

ચૂંટણી ભલે બ્રિટનમાં હતી, પરંતુ ભારતમાં પણ તેની ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેનું કારણ હતું ઋષિ સુનાકનું ભારતીય કનેક્શન. ભારતીય લોકો બ્રિટિશ ભારતીય નાગરિક સુનાકની જીતની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. સુનાક ભારતના જાણીતા વ્યક્તિત્વ નારાયણ મૂર્તિ (ઈન્ફોસિસના સ્થાપક)ના જમાઈ છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગીની પ્રક્રિયા ઓગસ્ટમાં શરૂ થઈ હતી. તેમાં પાર્ટીના કુલ 1.66 લાખ સભ્યોએ ભાગ લીધો હતો. બ્રિટનના વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સને રાજીનામું આપ્યું તે પછી વડા પ્રધાન પદ માટે જે નેતાઓનાં નામો બોલાતાં હતાં તેમાં ભારતીય મૂળના ઋષિ સુનાકનું નામ મોખરે હતું, જ્યારે લિસ ટ્રસનું નામ છેક છેલ્લા નંબરે હતું. લિસ ટ્રસ એક મીડિયોકર નેતા છે, જ્યારે ઋષિ સુનાક વધુ બુદ્ધિશાળી, વધુ તેજસ્વી, વધુ ધનવાન અને વધુ કુશળ નેતા હતા. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના મતદારોને લાગ્યું કે લિસ ટ્રસ તેમના જેવા જણાય છે, જ્યારે ઋષિ સુનાક કોઈ બીજી દુનિયામાંથી તેમની વચ્ચે આવી ચડ્યા હોય તેવું તેમને લાગતું હતું. આ કારણે જેમ જેમ પ્રચારની ઝુંબેશ આગળ વધતી ગઈ તેમ તેમ સુનાક પાછળ ધકેલાતા ગયા અને લિસ ટ્રસ આગળ આવતાં ગયાં. જ્યારે મતદાન થયું ત્યારે સુનાક 20,000 મતથી હારી ગયા હતા. લિસ ટ્રસને કુલ મતદાનના ૫૪ ટકા મતો મળ્યા હતા. કદાચ ઋષિ સુનાક ભારતીય મૂળના છે તે હકીકત તેમને નડી ગઈ હતી. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના નેતા તરીકે ચૂંટાવા માટે જ્યારે પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ત્યારે સુનાક તેમાં મોખરે હતા. પ્રારંભિક દિવસોમાં જેટલા પણ ઓપિનિયન પોલ યોજાયા તેમાં પણ સૌથી વધુ પોઈન્ટ સુનાકને મળ્યા હતા. પરંતુ પ્રચાર ઝુંબેશના ૬ સપ્તાહ પછી સ્થિતિ બદલાવા માંડી. તેમણે ઝુંબેશના છેલ્લા તબક્કામાં પાર્ટીના રૂઢિચુસ્ત મતદારોને પોતાની તરફેણમાં ખેંચવામાં સફળતા હાંસલ કરી હતી, પણ તે ખૂબ મોડું હતું. બ્રિટનનું અર્થતંત્ર જ્યારે ભયંકર કટોકટીમાં સપડાયું છે અને ઉર્જાનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે બ્રિટનને સુનાક જેવા કુશળ આર્થિક નિષ્ણાતની અને વહીવટદારની જરૂર હતી, પણ બ્રિટનના મતદારો કાંઈક અલગ રીતે જ વિચારતા હતા. તેમને લિસ ટ્રસનો કરવેરામાં ઘટાડો કરવાનો વિચાર બહુ ગમી ગયો હતો.

કરવેરામાં ઘટાડા દ્વારા જે ગાબડું પડશે, તેને કેમ પૂરવામાં આવશે, તેનો વિચાર તેઓ કરતા

નથી. સુનાકે પોતાની ચૂંટણી ઝુંબેશના પ્રારંભમાં એક સ્માર્ટ વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં બ્રિટનના ઉત્થાન બાબતમાં તેમના વિચારો ખૂબ આકર્ષક ઢબે રજૂ કરવામાં આવ્યા હતા. બોરિસ જોન્સને રાજીનામું આપ્યું તેના બીજા દિવસે જ ‘રેડીફોરરિધી’ નામનો વીડિયો રિલીઝ થયો હતો. આ નામની વેબસાઈટ પણ બહુ પહેલાં રજિસ્ટર થઈ હતી. તેમણે બોરિસ જોન્સનની ટીકા કરીને તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા, તેના ઘણા સમય પહેલાથી તેઓ વડા પ્રધાન પદે બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ઝુંબેશના પ્રથમ રાઉન્ડમાં તેમણે શાસક પક્ષના ૩૫૦ સંસદસભ્યોના જ દિલ જીતવાનાં હતાં. તે કામ આસાન હતું. તેમનો વીડિયો પણ તેમાં કામ લાગ્યો હતો, પણ તેમાં પર્સનલ ટચનો અભાવ હતો. સુનાકની પ્રચાર ઝુંબેશ હાઈ-ટેક અને હાઈ-પ્રોફાઈલ હતી, પણ તેને કારણે જ સંસદસભ્યો દૂર થતા ગયા હતા. પ્રથમ રાઉન્ડમાં તેમને ઘણા બધા સંસદસભ્યોના મતો મળ્યા, પણ તે ૫૦ ટકાથી ઓછા હતા. બીજા રાઉન્ડમાં પક્ષના સભ્યોમાં ઝુંબેશ કરવાની હતી, તેમાં ઋષિ સુનાકના મીડિયા મેનેજરો થાપ ખાઈ ગયા હતા. તેમણે તેમની તમામ તાકાત ઓનલાઈન કેમ્પેઈન પર કેન્દ્રિત કરી હતી, જ્યારે રૂઢિચુસ્ત પક્ષના બહુમતી મતદારો ગામડાંમાં રહે છે, જેઓ ઈન્ફોમેશન ટેકનોલોજી પર બહુ નિભર રહેતા નથી. ઋષિ સુનાક તરફથી આ મતદારોને રોજ મેસેજ કરવામાં આવતા હતા કે, તમારે આજે મારા વતી બે પક્ષસભ્યો સાથે વાતચીત કરવાની છે. આવા સંદેશો રૂઢિચુસ્ત પક્ષના મતદારોને જરાય પ્રભાવિત કરી શક્યા નહોતા. તેઓ ઈમેઈલ અને સોશિયલ મીડિયામાં આવતા સંદેશો બહુ ગંભીરતાથી લેતા નથી. તેથી તેમના મનમાં છાપ ઊભી થઈ ગઈકે સુનાક આપણા જેવા નથી.

હાઈ-ટેક સોશિયલ મીડિયા કેમ્પેઈનને કારણે આ છાપ વધુ મજબૂત બની ગઈ હતી. સુનાકે જે રીતે કેમ્પેઈન ચલાવી તેનાથી તદ્દન વિપરીત રીતે લિસ ટ્રસે પ્રચાર કર્યો. તેમણે પોતાના મતદારોને રૂબરૂ મળવાનું અને તેમની સાથે ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. અખબારોમાં અને ટીવીમાં આવતા તેમના ઈન્ટરવ્યૂ જોઈને રૂઢિચુસ્ત પક્ષના મતદારોમાં ધારણા બંધાઈ ગઈ કે આ નેતા આપણા જેવાં જ મધ્યમ વર્ગીય છે. લિસ ટ્રસને બીજો ફાયદો એ થયો કે, વિદાય લઈ રહેલા વડા પ્રધાન બોરિસ જોન્સને તેમને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. બોરિસ જોન્સને ભલે રાજીનામું આપ્યું, પણ રૂઢિચુસ્ત પક્ષમાં તેમના ઘણા ટેકેદારો હતા. તેમને લાગ્યું કે સુનાકને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, જેનો લાભ લિસ ટ્રસને મળ્યો હતો. વળી તેઓ મહિલા હોવાને કારણે મહિલા મતદારોની સહાનુભૂતિ પણ તેમને મળી હતી. ઋષિ સુનાકને આ વાતનો ખ્યાલ આવતાં છેલ્લે છેલ્લે આવ્યો, તેમણે બોરિસ જોન્સન સાથે સમાધાન કરવાની કોશિષ કરી હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.

બોરિસ જોન્સને તેમનો ફોન જ ઉપાડ્યો નહોતો. બોરિસ જોન્સને બદલો લીધો હતો. ઋષિ સુનાકની પત્ની અક્ષતા નારાયણ મૂર્તિની પુત્રી છે અને તે ભારતીય નાગરિક છે, તે બાબત પણ સુનાકને નડી હતી. અક્ષતા પાસે ઈન્ફોસિસના અબજ ડોલરના શેરો છે, તે સાંભળીને જ બ્રિટીશરોની આંખો પહોળી થઈ જતી હતી.

બ્રિટનમાં વેલ્થ ટેક્સ ન ભરવો પડે તે માટે તેમણે બ્રિટનની નાગરિકતા સ્વીકારી નહોતી.

manoj1968@yahoo.ca

## ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice

✓ Rat

**SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL**

✓ Cockroach

✓ Bedbug

**WE SPEAK ENGLISH, GUJARATI & HINDI**

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

### 24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

**CALL SANKET TRIVEDI - 647.339.3926**  
 Government Licensed Structural Exterminator

## DIVINE YOGA

By Geeta

### Children Yoga Class

Every Tuesday 5-6 PM

### Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :  
One to One Individual  
and Therapeutic

## Geeta Tailor

### 416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta



# અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ : હાઈવે ભક્તોથી ઊભરાયો

સેવાભાવી લોકો અને સંસ્થાઓએ સેવાકીય કેમ્પ 24 કલાક શરૂ કર્યા મહેસાણા

ભાદરવી પૂનમને લઈ માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં મહેસાણા અંબાજી હાઈવે માઈભક્તોથી ઊભરાયો છે. તથા માઈભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટ્યા છે. પગપાળા અથવા સંઘના માધ્યમથી ભક્તો માં અંબાના દર્શન માટે જઈ રહ્યાં છે.



મહેસાણા અંબાજી હાઈવે જય અંબેના નાદથી ગુંજ ઉઠ્યો છે. જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો માં અંબાના દર્શન માટે આતુર બન્યા છે. તથા માઈ ભક્તોની સેવામાં અનેક સેવા કેમ્પો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં સુવા, જમવા સાથે મેડિકલ કેમ્પો દ્વારા અંબાના દ્વાર સુધી સુવિધાઓ આપી રહ્યા છે. ભાદરવી પૂનમનું શક્તિપીઠ અંબાજીમાં ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. માં અંબાનો પ્રાગટ્ય દિવસ એટલે જ ભાદરવી પૂનમ.

ગુજરાતના ખૂણેખૂણેથી માઈ ભક્તો માં અંબાના પવનકરી દર્શન માટે અધીરા બન્યા છે. મહેસાણા

અંબાજી હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું છે. જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબા ના ખોળે પહોંચવા ગુજરાતના ખૂણેખૂણેથી અંબાજીની વાટ પકડી છે. મહેસાણા અંબાજી હાઈવે પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા તો કોઈ સંઘ દ્વારા પહોંચી રહ્યા છે. આ તમામ પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી લોકો, સંસ્થાઓ સેવાકીય કેમ્પ અવિરત 24 કલાક શરૂ કર્યા છે. રહેવા, જમવા સાથે આરામ તેમજ મેડિકલ સુધીની સેવા પૂરી પડતા સેવા કેમ્પો કાર્યરત છે.

## અંબાજીમાં 1 કિલો સોનું અને હારનું દાન કરાયું



રવિવારે અંબાજી મંદિરમાં અલગ-અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 1 કિ.લો સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે. સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અલગ અલગ દાતા દ્વારા સોનાના દાન કરવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે. પાલનપુરના એક માઈ ભક્ત દ્વારા એક કિલો સોનું દાન આપવામાં આવ્યું છે. 100 ગ્રામની 9 લગડી, 50 ગ્રામની 2 લગડી, જ્યારે બીજા એક દાતાએ 4 લાખ 80 હજારની કિંમતનો 105 ગ્રામનો એક સોનાનો હાર ભેટ આપ્યો છે. મુંબઈની પાર્ટી દ્વારા અંબાજીમાં દાન અપાયું છે.

# Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial  
24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :  
Our disinfectant services that we offer are:


- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

### All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

### Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets



Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

# ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

### Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

### Takeout & Catering

Limited થાળી  
(with sweet & Farsan)  
\$9.00 +Tax

Limited થાળી  
(without sweet & Farsan)  
\$7.50 +Tax



### CATERING SPECIAL

\$ 14.99 10 items  
+Tax  
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

### સ્પેશિયલ ડીલ ફોર નવરાત્રિ, ગરબા ઇવેન્ટ

દાભેલી \$ 1.25/Each | વડાપાંઉ \$ 1.25/Each | પાપડીનો લોટ \$ 1.25/Each

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા ભહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪ ૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

# અમુલના વા. ચેરમેનની ચૂંટણી: બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો વિજય

અમુલ ડેરીના સભાખંડમાં મતગણતરી હાથ ધરાઈ હતી, સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો

આણંદ

અમુલ ડેરીના નિયામક મંડળના ૧૩ સભ્યોની વર્ષ-૨૦૨૦ના ઓગસ્ટ માસમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થન ધરાવતા ૯ ડીરેક્ટર તથા ભાજપ સમર્થિત ૪ ડીરેક્ટરો ચૂંટાયા હતા. બાદમાં રાજ્ય સરકારના સહકાર વિભાગના ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂકને લઈ મામલો ગરમાયો હતો.

જેના વિરોધમાં તત્કાલીન વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ડીરેક્ટર કાંતિભાઈ સોઢાપરમાર તથા સંજયભાઈ

પટેલે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને આ નિમણૂકને રદબાતલ કરવા દાદ માંગી હતી. જેને લઈ કોર્ટના આદેશ અનુસાર યોજવામાં આવેલ વચગાળાની ચૂંટણી અંતર્ગત ત્રણ સરકારી પ્રતિનિધિઓના મત એક પેટીમાં અલગ તારવી જ્યાં સુધી આ વિવાદનો નિકાલ ન આવે ત્યાં સુધી મતગણતરી સ્થગિત કરવાનો કોર્ટ દ્વારા આદેશ થયો હતો. ચેરમેન પટે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે વાઈસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ

પરમાર અને રાજેશભાઈ પાઠકના ફોર્મ ભરાયા હતા. તાજેતરમાં હાઈકોર્ટમાં સુનાવણી થતાં ડેરીના નિયામક મંડળમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરવાના સરકારના હુકમને રદબાતલ કરાયો હતો. હાઈકોર્ટ દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક રદ કર્યા બાદ મતગણતરી થતાં ૧૫માંથી રાજેન્દ્રસિંહને ૯ મત જ્યારે રાજેશભાઈ પાઠકને ૬ મત મળતા ચૂંટણી અધિકારીએ રાજેન્દ્રસિંહ પરમારને વિજેતા જાહેર કર્યા હતા.

# નડિયાદમાં રોડના કામમાં નામ ન લખાતાં સાંસદ દેવુસિંહ અકળાયા

નડિયાદ

નડિયાદમાં એક્સપ્રેસ હાઈવેથી ગણપતિ મંદિર ચોકડી સુધીનો નેશનલ હાઈવેને જોડતો આશરે ૪.૨ કિ.મી. નો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. વાહનચાલકો ભારે હાલાકી ભોગવતા હતા. આજે રવિવારે આ રોડના સમારકામની કામગીરી આશરે પાંચ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થળ મુલાકાતે ગયેલા ધારાસભ્ય પંકજ દેસાઈએ તેના ફોટા પાડીને રોડનું કામ શરૂ થયા અંગે ફેસબુક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે ફક્ત તેમનું પોતાનું નામ લખીને જ આ કામ શરૂ થયાનો બધો જશ એકલાએ જ

ખાટવાનો પ્રયાસ કર્યો હતો.

આ ફેસબુક કોમેન્ટ સાંસદ દેવુસિંહ ચૌહાણના ધ્યાને આવતા તેઓએ પંકજ દેસાઈને ફેસબુક પર કોમેન્ટ કરી હતી કે 'ભાઈશ્રી પંકજ ભાઈ, જય મહારમજી..આ રોડ ભારત સરકારના વિભાગમાંથી જેને તાત્કાલિક મંજૂર કરાવી આપ્યો હોય તેનું નામ લખવું જોઈએ તેટલી તો ખેલદિલી હોવી જોઈએ. તમારા ઘણા કામ મંજૂર કરાવી આપ્યા છે પણ ખેલદિલીનો ગુણ કેળવશો તો મોટા કહેવાશો' સાંસદની આ પ્રમાણેની કોમેન્ટ બાદ ધારાસભ્યએ ફેસબુકમાં તેમનું પણ નામ પાછળથી ઉમેર્યું હતું.

# નડિયાદમાં ન્યુ ભારત હિંગ સપ્લાયર્સની ઓફિસ ઉપર NIAના દરોડા

વડોદરા

એનઆઈએ દ્વારા નડિયાદમાં ન્યુ ભારત હિંગ સપ્લાયર્સની કિખા હિંગની ઓફિસ પર ટેરર ફંડના મામલે દરોડા પાડવામાં આવ્યા હતા. હિંગ કંપનીની માલિક અસ્મા પઠાણ દ્વારા કરોડો રૂપિયાના ટેરર ફંડને લઈને વ્યવહાર કરાયાની બાતમીને આધારે એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અસ્મા પઠાણ દિલ્હી વક્ફ બોર્ડના મેમ્બર છે અને ભાજપ સાથે સંકળાયેલા છે. સોમવારે સવારે પાંચ વાગે એનઆઈએની ટીમ અચાનક જ મરીડા રોડ પર આવેલી ન્યુ ભારત હિંગ સપ્લાયર્સની ઓફિસ અને અસ્મા પઠાણના અમદાવાદી બજારમાં આવેલા મકાન પરન પહોંચી હતી. અને એનઆઈએને અનેક મહત્વના પુરાવાની વિગતો મળી છે.

# ટટ્ટુ રાખી ગેરમાર્ગે દોરતી પાર્ટીઓને ગુજરાતમાં ઘૂસવા ન દેતાં : પાટિલ

વડોદરા

વડોદરામાં ભાજપ દ્વારા બનાવવામાં આવનાર કાર્યલયનું ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, જે પાર્ટી ભાડાના લોકોને રાખીને ગેરમાર્ગે દોરે છે અને અર્બન નક્સલીને ટિકિટ આપે છે તેમને ગુજરાતમાં ઘૂસવા ના દેતાં. વડોદરામાં સીઆર પાટિલે આપ પર પ્રહાર કર્યા હતા અને તેમણે કાર્યકરોને કહ્યું- આંખમાં તેલ નાખીને જાગતા રહેજો. ગુજરાત એક વિકાસનું મોડેલ છે. ભાજપના કાર્યકર્તા દેશના ભાજપ કાર્યકર્તા માટે મોડલ કાર્યકર્તા છે. દેશના ભાજપ


કાર્યકર્તા પણ ગુજરાત ભાજપ કાર્યકર્તાની કામગીરીનું અનુકરણ કરે છે. ભાજપ માટે કહેવાય છે પાર્ટી વિથ ડિફરન્સ. જીત મેળવવી એ ભાજપ કાર્યકર્તાની પરંપરા છે. ભાજપ બે દસકાથી એકપણ ચૂંટણી હારી નથી, કેમકે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા છે. ભાજપના કાર્યકર્તાઓએ ૧ કલાકમાં ૮ કરોડનું ફંડ ભેગું કર્યું, જેનો ગર્વ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે આયોજિત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ચૂંટણી આવી એટલે અનેક પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય બની છે.

# ભાભર ખાતે ગૌમાતાના અધિકાર માટે સંતો મહંતોનું મહાસંમેલન

વડોદરા

બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાભર જલારામ ગૌ શાળા સંચાલિત હરિધામ ગૌશાળા ખાતે સમગ્ર ગુજરાતના સાધુ સંતો અને ગૌશાળા, પાંજરાપોળ સંચાલકોનું એક મંચ સંમેલન યોજાયું હતું. ગૌ માતા અધિકાર સંમેલનમાં ગાયો માટે ઘાસચારો અપાય, લખ્ખી વિરોધી રસી શોધવા, કતલખાના બંધ કરાવી ગૌ હત્યારા સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરાઈ હતી. જો એક સપ્તાહમાં તમામ માંગોનું અમલીકરણ નહીં થાય તો ગૌશાળાઓને તાળા મારી તંત્રને ચાવી આપી ગાંધીનગર ખાતે આંદોલન, ધરણા ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાભરની જલારામ ગૌશાળામાં પાંચ હજારથી વધુ લુલી લંગડી અને અકસ્માત ગ્રસ્ત ગૌવંશનો નિભાવ થાય છે.



## UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

**ZIVASA**  
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana  
Broker



# આયુષ્માન ભારતમાં સુરતના ડોક્ટરનું 33 લાખનું કૌભાંડ : તપાસ વેળા ભાંડો ફૂટ્યો

ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી સાથે મળીને કુલ 69 જેટલા ક્લેમ પાસ કરાવી દીધા

**સુરત**  
ગાંધીનગરના ઈન્ફોસિટી સુપરમોલ ખાતે આવેલી વિડાલ હેલ્થ ઈન્સોરન્સ કંપનીના ગુજરાત હેડ ટિપ અજમેરસિંગ વર્માએ આ બાબતે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિડાલ કંપની ઓરીયન્ટલ ઈન્સોયરન્સ કંપની સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભારત હેઠળ જે દર્દીઓ સારવાર કરાવે તેઓનો સારવારનો ખર્ચ આપવાનું કામ આ કંપની દ્વારા

કરવામાં આવે છે. જેનો કોન્ટ્રાક્ટ વર્ષ 2017થી 2020 દરમિયાનનો હતો. જે સમયે આયુષ્માન યોજના અંતર્ગત ક્લેમ કરવામાં આવે તો સરકારના સર્વરમાં ઓનલાઇન મુકીને તે ફાઇલ સરકારના સર્વરથી જ વિડાલ કંપનીમાં આવતી હતી. આ ફાઇલ કંપનીમાં પહોંચ્યા બાદ તેનું ચેકીંગ કરીને મંજૂરી આપવામાં આવે અને પૈસાટ્રાન્સફર કરવા માટે એક્સેલ ફાઇલ મોકલી આપતા હતા. આ એક્સેલ ફાઇલ બનાવવાનું કામ તે વખતે કુણાલ બોડલે

સંભાળતો હતો. કુણાલે આ સમય દરમિયાન તેણે સુરતની સમર્પણ જનરલ અને મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ડો. રસિક વિરાણી સાથે મળીને ખોટી રીતે 6૯ જેટલા ક્લેમ એપ્રુઅલ આપી દિધા હતા. એટલુ જ નહીં, અલગ અલગ કિસ્સામાં કુલ ૩૩ લાખ રૂપિયા પણ ચૂકવી દેવામાં આવ્યા છે. સરકારના સર્વરનો ડેટા ચેક કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે સુરતમાં કલેક્ટરની કક્ષામાં બેઠક પણ કરવામાં આવી હતી.

# ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન

**મુંબઈ**  
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક રોડ અકસ્માતમાં અવસાન થયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર પાસે બપોરે ૩:૩૦ કલાકે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. સૂર્યા નદી પુલ પર ડીવાઈડર સાથે અથડાવાના કારણે કારનો અકસ્માત થયો હતો અને પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીના અવસાનની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી છે. કારમાં કુલ 4 લોકો સવાર હતા જે પૈકીના 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે



અન્ય 2 ઈજાગ્રસ્તોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના કાસા ગામના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને ગુજરાતની હદમાં કોઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

## સુરતના 20 સ્થળોએ એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ ગોઠવાશે

**સુરત**  
સુરતમાં પ્રદુષણ અટકાવવા માટે પાલિકાએ શહેરના જુદા જુદા 20 સ્થળોએ એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત પાલિકા જર્મનીની સંસ્થા જી આઈ ઝેડના સહયોગથી એક ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ શરૂ કરશે તેના માટે શહેરના 20 સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. અભિયાનમાં સુરત મહાનગરપાલિકા પણ જોડાયું છે. સુરત મ્યુનિ. તંત્રએ આજે સાયન્સ સેન્ટર ખાતે એક ચર્ચાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લ્યુ સ્કાય-2022 અંતર્ગત શહેરમાં જુદા જુદા 20 સ્થળે એર ક્વોલિટી સેન્સર આધારિત મોનિટરીંગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય કર્યો છે.

## સુરતના બિલ્ડરે ભાગીદારોથી કંટાળીને પૌતાની કન્સ્ટ્રક્શન સાર્થક પર ઝેર પીધું

**સુરત**  
અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક વેસ્ટર્ન સેવન સીઝ બંગલોમાં બિલ્ડર અનિલ રમણ પટેલ રહે છે. તેઓ મંગળવારે સાંજે 8 વાગ્યે રોજના કમ મુજબ ઘરે પહોંચ્યા ન હતા. તેમનો મોબાઈલ ફોન પણ બંધ હોવાથી પરિજનોએ શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન તેઓ પાલ ગૌરવ પથ રોડ પર તેમની કન્સ્ટ્રક્શન સાર્થકના પાર્કિંગમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બિલ્ડર અનિલ પટેલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્વભાવે મિલનસાર અનિલ પટેલના આપઘાતની જાણ થતા

સગાસંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને અડાજણ પોલીસ પણ દોડી આવી હતી. પરિવારને અનિલભાઈના પેન્ટના બિસ્સામાંથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. બિલ્ડર અનિલ પટેલ પ્રેસનોટમાં લખ્યું હતું કે, જતીને 3 મહિનાથી માનસિક ત્રાસ આપ્યો છે, સાથે શંકરકાકા પણ એ જ રીતે વર્તન કરતા હતા, હવે સહન નથી થતું. હું કોઈ કસ્ટમર કે વેપારીને જવાબ નથી આપી શકતો, મારે રોજ નવા નવા બહાના બતાવવા પડે છે. મારી મોતનું કારણ શંકરકાકા, જતીન અને ગણપતકાકા છે. મને કોઈ સમજવા જ રાજી નથી. બહુ સમજાવ્યા પણ મને આપઘાત કરવા મજબૂર કરી દીધો.

## સુરતના 9 સાહસિકોએ હિમાલયનું માઉન્ટ ફેન્ડશિપ શિખર સર કર્યું

**સુરત**  
સુરતના 9 સાહસિકોએ હિમાલયનું 5289 મીટર એટલે કે 17353 ફૂટની ઊંચાઈએ આવેલું માઉન્ટ ફેન્ડશિપ શિખર સર કર્યું હતું. ખરાબ હવામાન અને અન્ય પ્રશ્નોને કારણે 9 સાહસિકો પૈકી 7 સભ્યો 16500 અને 2 જ સભ્યો 17353 ફૂટની સપાટીએ પહોંચી શક્યા હતા. સુરતના 7 જેટલા સાહસવીરોએ હિમાલયના પીરપંજાબ રેન્જમાં આવેલા આશરે 17353 ફૂટ ઊંચા માઉન્ટ ફેન્ડશિપ સર કરવાનું આયોજન કર્યું હતું. તેમાં સુરતના કલ્પેન શાહ, પીયૂષ કેળાવાલા, સંજય પટેલ સહિતના સાહસિકો જોડાયા હતા. ખરાબ હવામાન અને ઓછી માત્રામાં ઓક્સિજનને કારણે શિખર સર કરવું કઠિન સાબિત થયું હતું. સાહસિકો સૌપ્રથમ મનાલી જવા રવાના થયા હતા.



**SHARP**  
INTERNATIONAL  
IMMIGRATION SERVICES

**CANADA**  
**IMMIGRATION**



**SPOUSAL SPONSORSHIP**  
**SPECIALIST (98 percent success ratio)**

**Last minute student admission**

Please contact us on

**416-745-2466 or 91-9428973911**

- Conestoga
- Seneca
- Humber
- Lambton

- Fanshawe
- Georgian
- Algoma
- Canadore

- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

**ONLINE IELTS**  
**SPOKEN ENGLISH CLASSES**  
**ON ZOOM**

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS / DETENTION REVIEWS / CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

<b>CANADA</b>	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
<b>VADODARA</b>	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
<b>AHMEDABAD</b>	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

**: Specialized in :**

**Job Offer & LMIA**

**Entrepreneur**

**Investor Business**

**Self Employed**

**Farm Investor**

Email.: info@siis.ca Website.: www.siis.ca



# રાજકોટમાં ચૂંટણી પૂર્વે ટિકિટ માટે ભારે ઘમસાણ, દરેકે પક્ષમાં જૂથવાદ-અસંતોષ

રૂપાણીની સીટ પર ડો.દર્શિતા શાહનું પણ ચર્ચામાં: ભાજપ, કોંગ્રેસ તેમજ આપમાં અનેક દાવેદારો

## રાજકોટ

રાજકોટની ધારાસભાની ચાર બેઠકો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હોય ભારે ઘમસાણ જામ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાં જૂથવાદ અને આંતરિક અસંતોષ દેખાઈ રહ્યો છે.

સૌથી વધુ મહત્વની મનાતી રાજકોટ-૬૮ પશ્ચિમ બેઠક પર ગત ચૂંટણીમાં તો વિજય રૂપાણી સર્વામાન્ય અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી હતા પરંતુ, હવે સમીકરણો બદલાયા છે. શહેર ભાજપમાં જૂથવાદ સર્વવિદિત છે. આ બેઠક પર કલ્પક મણિયાર, કમલેશ મિરાણી સહિત સવર્ણના નામો ચર્ચામાં આવ્યા બાદ તાજેતરમાં ખુદ વિજય રૂપાણીએ આ બેઠક પર લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે રાજકીય વર્તુળોમાં આ બેઠક માટે ડેવુટી મેયર અને બીનવિવાદાસ્પદ તથા સંઘ પરિવાર

સાથે પેઢીઓથી જોડાયેલા ડો.દર્શિતા શાહનું નામ પણ ચર્ચામાં છે. તો આ બેઠક પર ભાજપ સામે લડનાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ હવે આમ આદમી પાર્ટીમાંથી લડે તેવી શક્યતા છે જ્યારે કોંગ્રેસનું આ વિસ્તારમાં પહેલેથી વોર્ડ નં.૩ને બાદ કરતા બાકીના વોર્ડ નં.૧,૨,૮,૧૦ વગેરેમાં ક્રિદિ બહુમતિ મળી નથી. ભૂતકાળમાં ત્યાં ભાજપ સામે કોંગ્રેસે અતુલ રાજાણીને ટિકિટ આપી હતી અને હવે કોઈ બીનસક્રિય નેતાનું નામ પ્રગટ થવાની શક્યતા છે.

શહેરમાં રસાકસીવાળી પૂર્વ-૬૮ બેઠક પર પુનઃ ચૂંટણી લડવા હાલના મંત્રી અરવિંદ રૈયાણી ઉત્સુક છે પરંતુ, તે સર્વમાન્ય નામ નથી, ભાજપના અન્ય દાવેદારો છે તો કોંગ્રેસને આ બેઠક ઓછી જોખમી લાગતી હોય મહેશ રાજપૂત, ભાનુબેન સોરાણી, અશોક ડાંગર સહિત નેતાઓ દાવેદારો છે. આમ આદમી પાર્ટી અગાઉ જ્યાંથી રાજ્યગુરુ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ તે

આ બેઠક પર નામ જાહેર કરી શકી નથી. રાજકોટ-૭૦ બેઠક પર આમ આદમી પાર્ટીએ ખોડલધામ સાથે જોડાયેલા શિવલાલ બારસિયાનું નામ જાહેર કરી દીધું છે, જ્યારે ભાજપમાં ગોવિંદ પટેલ ચૂંટણી લડવા ઈચ્છુક છે પરંતુ, ભાજપ ત્યાં ઉમેદવાર બદલાવે તેવી શક્યતા વચ્ચે ભરત બોધરા સહિત અનેક નામો ચર્ચામાં છે. જ્યારે રાજકોટ અનામત બેઠક પર આપના વશરામ સાગઠીયા ઉમેદવાર તરીકે જાહેર થયા છે, ભાજપમાં લાખા સાગઠીયાને રિપીટ કરાય તેવી શક્યતા છે પરંતુ, ભાજપના અન્ય નેતાઓએ ત્યાં ટિકિટની માંગણી કરી છે. કોઈ પણ પક્ષમાં રાજકોટની આ ચાર બેઠકો માટે સર્વસંમતિ નથી. સત્તા ભોગવી ચૂકેલા અને પક્ષમાં વર્ષોથી સક્રિય પણ ટિકિટથી વંચિત તમામને ટિકિટ જોઈએ છે. ભાજપ, કોંગ્રેસમાં જૂથવાદ તો દેખાય છે આમ આદમી પાર્ટી પણ નેતાઓ વધતા તેનાથી અલિપ્ત નથી.

# ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ આપવા વિચારણા : સી.આર.પાટિલ

ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખે લોકોને મળી સુચન લીધા

## ભાવનગર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ આપવા માટે વિચારણા ચાલી રહી છે તેથી મહિલાઓ ચૂંટણી લડવા તૈયાર રહે તેમ રવિવારે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખે મહિલા સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ બે દિવસ રોકાયા હતા અને અનેક લોકોને મળી સુચન લીધા હતાં.

ભાવનગર શહેરમાં વન ૩ વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ આવેલ છે. આજે રવિવારે ચાર જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, સાહિત્યકારો, કલાકારો સાથે બેઠક કરી હતી. આ કાર્યક્રમમાં આવેલ સાધુ-સંતો, પુજારીઓએ કેટલીક માંગણીઓ કરી હતી અને જુદા જુદા સુચન કર્યા હતાં.



ત્યારબાદ જવાહર મેદાન ખાતે સવારે લાભાર્થીઓ અને મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ આપવા વિચારણા ચાલી રહી છે. મહિલાઓની પ્રગતિ થાય તેવું વડાપ્રધાન ઈચ્છી રહ્યા છે. મહિલાઓ માટે સરકારે ઘણી યોજનાઓ પણ જાહેર કરી છે અને આ યોજનાનો લાભ લેવા મહિલાઓને જણાવવામાં આવ્યું હતું. મહિલાઓને વધુ ટિકિટ આપવાની વાતના પગલે મહિલા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફરી વળી હોવાનું ચર્ચાય રહ્યું છે.

# રાજકોટમાં યુવાનની હત્યાથી દોડધામ પુરાયેલો આરોપી પણ ભાગી છૂટ્યો

હત્યા કરનાર પ્રશાંતને અન્ય રૂમ પાર્ટનરે પકડી રૂમમાં પુરી દીધો હતો

## રાજકોટ

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિપાર્ક નજીક ગીતા ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે વહેલી સવારે શહેરના કોઠારીયા મેઈન રોડ સ્વાતિપાર્ક નજીક આવેલી ગીતા ઈન્ડસ્ટ્રીઝ એરિયાની ઓરડી પાસે પરપ્રાંતીય યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ 108 દોડી ગઈ હતી. આજીએમ પોલીસ મથકનો

પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનને મોઢા પર તેમજ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

મૃતકનું નામ સુરેશ રાજેન્દ્ર ભુઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવક પોતે મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું અને મજૂરી કામ કરી પોતાનું

ગુજરાત ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સુરેશ જે ઓરડીમાં રહેતો ત્યાં તેની સાથે તેનો મિત્ર પ્રશાંત પણ રહેતા હતા. પ્રશાંતે અને સુરેશ વચ્ચે ઝઘડો થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કરનાર પ્રશાંતને અન્ય રૂમ પાર્ટનરે પકડી રૂમમાં પુરી દીધો હતો. પરંતુ સ્યુસાઈડ કરી લેવાની ધમકી આપતા રૂમનો દરવાજો ખોલતા જ ભાગી ગયો હતો.



તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

1 LB \$20 વધુ દર LB ના \$6  
 11 LB \$55 વધુ દર LB ના \$6  
 23 KG \$185, વધુ દર KG ના \$10  
 30 KG \$230, વધુ દર KG ના \$10

ખાવા-પીવાની વસ્તુ  
 USA મોકલવા માટે  
 FDA ની એપ્રુવલ  
 અમે કરી આપીશું  
 (Extra Charge)

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની  
 હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West )	Scarborough	Mississauga
519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM	WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM	WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: SAT-SUN :----- 11.00 AM to 5.00 PM -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM ----: WEEKENDS :---- 11.00 AM TO 5.00PM

૬૪૭-૭૬૧-૧૩૧૭

www.firstflightcanada.com

**WANTED HOTEL MANAGER**  
 Motel Manager for 13 Unit Motel, live in Quarter two bedroom plus \$30,000 salary per year, two weeks holiday pay, duties are answer phone, check in customer, clean rooms, laundry, banking, etc.

Contact Information

Manoj Parekh 250-691-1322 or  
 email : babasai2007@gmail.com

**સ્વદેશ**  
 CANADA  
 Registration # 869127209  
 Publication Mail Agreement /  
 Email : info@swadesh.news

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**  
 MAILING ADDRESS  
 23 Lyric Road,  
 Brampton ON L6S 0B4.  
 416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor : Manoj Gandhi

Director & Publisher : Rameshbhai Vyas

Director Marketing : Pareshkumar Champakbhai Peshwa

Director : Nilesh Tailor

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

Designed By


Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)





## પુષ્પા ટુ માટે અલ્લુ અર્જુનને રૂ. 125 કરોડ ચૂકવાશે

મુંબઈ : ગયાં વર્ષે આશ્ચર્યજનક રીતે સમગ્ર દેશમાં સુપરહિટ થયેલી ફિલ્મ પુષ્પાના બીજા ભાગ માટે મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનને ૧૨૫ કરોડ ચૂકવવામાં આવી રહ્યા હોવાની માહિતી છે. આ વિગત ખોતાં અલ્લુ અર્જુન હાલ બોલીવૂડના સલમાન અને અક્ષય કુમારની હરોળમાં પહોંચી ચૂક્યો છે. અક્ષયની ફી હાલ ૧૨૫ કરોડ છે. સલમાન ખાન તેની નવી ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી ખાન માટે લગભગ આટલી જ રકમ ઓફર થઈ છે. બીજા ભાગ પુષ્પા ધી રુલનું કેટલુંક શૂટિંગ બંગાળના બાંકુરામાં થવાનું છે એ વાત લીક થઈ ગઈ હતી.

FRIDAY, 09 SEPTEMBER, 2022



# સ્પર્દા

07



## પાકિસ્તાની ક્રિકેટર સાથેની રીલ શેર કરતા ઉર્વશી રૌતેલા ટ્રોલરોના નિશાને

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં દુબઈમાં ચોખ્ખાં રહેલા એશિયા કપની અનેક ક્રિકેટ મેચોમાં જોવા મળી રહી છે. ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલા સમયથી ચર્ચામાં છે. અત્યાર સુધી તેનું નામ ભારતીય ક્રિકેટર અખિલ પંત સાથે જોડવામાં આવતું હતું. જો કે તાજેતરના એક વીડિયોથી તે એકવાર ફરીથી ચર્ચામાં આવી છે અને આ વખતે તેનું કારણ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ છે. ઉર્વશી રૌતેલાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર એક રોમેન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ પણ જોવા મળી રહ્યા છે અને આ કારણે ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં ઉર્વશીએ જે વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર શેર કર્યો હતો અને તેને કોઈ સોશિયલ મીડિયા ચુસ્કે બનાવ્યો હતો. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો હતો.



## જેનિફર આશિકી-૩ની રેસમાંથી બહાર, કોઈ ફ્રેશ ચહેરાની શોધ

મુંબઈ : આશિકી થીમાં કાર્તિક સામે હિરોઈન તરીકે જેનિફર વિગનેટની પસંદગી થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી. પરંતુ, હવેની માહિતી પ્રમાણે જેનિફર આ રેસમાંથી બહાર નીકળી ગઈ છે. ફિલ્મ વર્તુળોમાં જેનિફર ઉપરાંત શ્રદ્ધાનું નામ પણ ચર્ચાવા લાગ્યું હતું પરંતુ મેકર્સ દ્વારા સતવાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે હજુ સુધી હિરોઈન તરીકે કોઈનું નામ ફાઈનલ થયું નથી. ૨૦૧૩માં આશિકી ટૂ આવી ત્યારે આદિત્ય રોય કપૂર કે શ્રદ્ધા કપૂર બેમાંથી કોઈ ખાસ જાણીતા ન હતા. પરંતુ, આશિકી થી આવે તે પહેલાં કાર્તિક આર્યન ઓલરેડી બોલીવૂડનો સેલેબલ સ્ટાર બની ચૂક્યો છે. આથી તેની સામે હવે હિરોઈન તરીકે કોઈ નવા ચહેરાને તક અપાય તેવી શક્યતાઓ વધુ છે એમ માનવામાં આવી રહ્યું છે.



## Boycott Bollywood ટ્રેન્ડ પર સ્વરા ભાસ્કરનું નિવેદન : કહ્યું 'ઘંઘો છે...'

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. સ્વરા તેની ફિલ્મો કરતાં દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવા માટે જાણીતી છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર બોલિવૂડ ફિલ્મોનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. સ્વરા ભાસ્કરે તેના દિવટર હેન્ડલ પર જેમ્સ ઓફ બોલિવૂડ નામના પેજ પર કરવામાં આવેલી પોસ્ટને રી-ટ્વીટ કરી છે. અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે, "બ્રહ્માસ્ત્રને સપોર્ટ આપવા કરતાં સારું છે કે, જેમ્સ ઓફ બોલીવૂડને સપોર્ટ કરો અને રણબીર કપૂરનાં દર્શન મેળવો. બાકી તમારા પૈસા ફ્લાઈ ખાનને સ્પોન્સર કરવા, ડેવિડ હેડલીને હગ કરવા અને 2611 માટે હિંદુઓને દોષ આપવા માટે ઉપયોગમાં આવશે નહીં. આ જ પોસ્ટને રી-ટ્વીટ કરીને અભિનેત્રીએ લખ્યું, "ઘંઘો છે! બાયકટ બોલીવૂડનો પ્રોફિટેબલ બિઝનેસ."

## જહાંવી કપૂરે ઈન્સ્ટા પર બોલ તસવીરો શેર કરી


મુંબઈ : જાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર બોલડનેસની બધી હટો પાર કરી દીધી છે. જાનવી અનેક રીતે સોશિયલ મીડિયામાં ઇવાયેલી રહે છે. જાનવીએ ઈન્સ્ટા પર ૭ તસવીરો શેર કરી જેમાં એકથી એક તસવીર ચઢિયાતી છે. આ તસવીરમાં જાનવી સ્લીવલેસ કોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં જાનવી ખૂબ જ બોલડ લાગી રહી છે. આ તસવીર જોતાની સાથે ફેન્સ પણ અનેક વિચારમાં પડી ગયા છે. આ તસવીરમાં જાનવીએ વાળ ખુલ્લા રાખ્યા છે જે એની હોટનેસમાં વધારો કરે છે. આ બોલડ અંદાજમાં જાનવીએ અલગ-અલગ અનેક પોઝ આપ્યા છે. એક-એક પોઝમાં જાનવી હોટ દેખાઈ રહી છે. જાનવી કપૂરે આ તસવીરો શેર કરતા લખ્યું છે કે, જાનવી કપૂરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. જો કે આ તસવીરને માત્ર ૨ કલાકમાં જ સવા છ લાખ લોકોની લાઈક મળી ગઈ છે. આ સાથે જ ૩૮૦૦ જેટલી કમેન્ટ્સ પણ લોકોએ કરી દીધી છે. આ કોમેન્ટમાં અનેક લોકોએ જાનવીની

સાઈડથી ચાલ્યા છે જેમાં લોકોએ બ્યુટીફુલ, લુકિંગ હોટ, ફાયર જેવી અનેક પ્રકારની કમેન્ટ્સ કરી છે. સોશિયલ મીડિયા પર જાનવીની આ તસવીર ધડાધડ વાયરલ થઈ રહી છે. લાસ્ટમાં જાનવી ગુડ લક મુવીમાં જોવા મળી હતી. એક્ટ્રેસ જાનવી કપૂર એની બોલડ અદાઓ માટી કેમસ છે. આ સાથે જ તમને ખ્યાલ હશે કે જાનવી આ દિવસોમાં એનું છેલ્લું મુવી એટલે ગુડ લકમાં જોવા મળી હતી. આ મુવીમાં ફેન્સને જાનવીનો રોલ ઘણો પસંદ આવ્યો હતો. જાનવી કપૂરે ધડક બોલિવૂડ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ થતાની પહેલા જ મોમ શ્રીદેવીનો મોત થયું હતું. સિસ્ટર ખુશી કપૂર પણ જલદી ફિલ્મોમાં જોવા મળશે -જાનવી કપૂરની બહેન ખુશી કપૂર પણ ઓછા સમયમાં તમને ફિલ્મમાં જોવા મળશે. ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ધ આર્ચીઝ મુવીનું ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં ખુશી સિવાય સોહાના ખાન અને અગસ્ત્ય નંદાની પણ મહત્વની ભૂમિકા છે. જાનવી કપૂરની તસવીરો પર ફેન્સ દિલ ખોલીને કમેન્ટ્સ કરતા હોય છે.



## બોલીવૂડને આશા બંધાઈ, 'બ્રહ્માસ્ત્ર'નું બમ્પર એડવાન્સ બૂકિંગ, દોઢ લાખ ટિકિટો વેચાઈ

ફલોપ ફિલ્મોની વણઝાર વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ૭ સપ્ટેમ્બરે રિલિઝ થવા જઈ રહી છે અને તેના પર આખા બોલીવૂડની નજર છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મના બોયકોટની થઈ રહેલી માંગ વચ્ચે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મનું બમ્પર એડવાન્સ બૂકિંગ થઈ રહ્યું છે. આ મામલામાં કાર્તિકની સુપર હિટ ફિલ્મ ભૂલ ભુલેયા પાર્ટ 2ને બ્રહ્માસ્ત્રે પાછળ રાખી દીધી છે. હોન્ડી વર્ગનમાં એડવાન્સ બૂકિંગના મામલામાં હવે બ્રહ્માસ્ત્ર ફિલ્મ માત્ર કેલુએફ પાર્ટ ટુથી જ પાછળ છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બ્રહ્માસ્ત્રની દોઢ લાખ ટિકિટો મંગળવારે રાત સુધીમાં વેચાઈ ચુકી છે. ફિલ્મની રિલિઝને બે દિવસ બાકી છે ત્યારે આ આંકડો હજુ પણ વધી શકે છે. એડવાન્સ બૂકિંગનો આ આંકડો પણ દેશના ત્રણ સૌથી મોટા મલ્ટીપ્લેક્સ ચેનનો જ છે અને આ ત્રણ કંપનીના મલ્ટીપ્લેક્સમાં એડવાન્સ બૂકિંગ થકી બ્રહ્માસ્ત્રનું કલેક્શન 4.50 કરોડ રૂપિયા અત્યારથી જ થઈ ગયું છે.



## SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009

Limited Time Offer

Guaranteed!!! \$500,000 CASH VALUE\*

At the age of 65 with Life Insurance of a Million Dollar.

\*Plan is suitable for age upto 45!

Call for more details

JAGDISHBHAI SEVAK

Insurance Broker

647-236-7620

sevak\_2007@hotmail.com • www.shivfinancialservices.ca



\*Disclaimer: This policy is offered by UV Insurance. Everyone may not be eligible for this policy. Smaller face amounts of life insurance also available. Our licensed advisors do comprehensive life insurance and financial needs analysis. Tax applicable at the time of withdrawal. In the case of death, benefits are tax-free.





# MADHUR - YATRI & CHORUS GROUP - 2022 NAVRATRI "RAAS GARBA"

**SOLD OUT****Brampton  
Saturday  
24 Sep 2022****Waterloo  
Friday  
30 Sep 2022****Markham  
Saturday  
01 Oct 2022****Scarborough  
Friday  
07 Oct 2022****Brampton  
Saturday  
08 Oct 2022**

## મધુર યાત્રી અને કોરસ ગ્રુપ ૨૦૨૨ નવરાત્રી રાસ ગરબા

**Shiv Financial  
Services**  
presents**Ticket  
\$15  
per person  
Children under  
4 FREE****Madhur Yatri & Chorus Group**To support Sri Radha Krishna Temple of Scarborough  
**Saturday - Sep 24, 2022 @ 7.00pm****Venue: Hindu Sabha****9225 The Gore Rd, Brampton ON L6P 0B6**

For ticket &amp; more info:

**Jagdish Sevak: 647-236-7620**  
**Manisha sevak: 647-770-3876**

૨૦૨૨ નવરાત્રી રાસ ગરબા મા મધુર યાત્રી અને કોરસ ગ્રુપ ના તમામ કલાકાર નવરાત્રી ને પૂર જોશમા ઉજવવા માટે સુંદર ગરબા અને રાસ સાથે સંગીત ની સમજટ માનવા તૈયાર છે. બે વર્ષ ના કોવિડ-૧૯ ના મહામારીએ પછી હવે સમય આવ્યો છે નવરાત્રીની માતાજી ની આસ્થાને પરિપૂર્ણ કરવા માટે અને આ સુંદર સમય ને શ્રદ્ધા સાથે ભરપૂર આનંદ માણી કોવિડ-૧૯ ને વિદાય આપવી છે. યાત્રી મધુર યાત્રી અને કોરસ ગ્રુપ ના કલાકાર સાથે આપ નવરાત્રીને જ્ઞાનદાર ઉજવવા માટે તૈયાર થઈ જાઓ ૭ ઓક્ટોબર ૨૦૨૨ ને શુક્રવારે સાંજે ૭ વાગે સાઈ મંદિર મારખમ મા પ્રવેશ ફી વગર રાસ ગરબા ની મજા માણો. વધુ માહિતી માટે ૪૧૬ ૫૭૫ ૫૩૧૨ સંપર્ક

**Kitchner-Waterloo  
Community**  
presents**Ticket  
\$15  
per person  
Children under  
4 FREE****Madhur Yatri & Chorus Group****Friday - Sep 30, 2022 @ 7.00pm****Venue: Albert McCormick Community Centre**500 Parkside Drive, Waterloo, Waterloo ON N2L 5J4  
entrance through Waterloo Public Library doors on old Albert Street

For ticket &amp; more info:

**Kamal Singh: 226-338-1474**  
**Gayatri Singh: 226-606-1647****24 Gam Patidar  
Samaj**  
presents**Ticket  
\$15  
per person  
Children under  
4 FREE****Madhur Yatri & Chorus Group****Saturday - Oct 01, 2022 @ 7.00pm****Venue: Armenian Community Centre of Toronto**

45 Hallcrown Pl, North York, ON M2J 4Y4

For ticket &amp; more info:

**Mahender Patel: 647-454-5830****Sai Mandir**  
સાઈ મંદિર  
presents**FREE  
Entry****Madhur Yatri & Chorus Group****Friday - Oct 07, 2022 @ 7.00pm****Venue: Sai Mandir સાઈ મંદિર**

2721 Markham Rd, Unit # 6

Toronto Ontario M1X 1N5

For more info:

**Raghu : 416-575-5312****Dashkoshi Leuva  
Patidar Samaj**  
presents**Ticket  
\$15  
per person  
Children under  
4 FREE****Madhur Yatri & Chorus Group****Saturday - Oct 08, 2022 @ 7.00pm****Venue: Hindu Sabha****9225 The Gore Rd, Brampton ON L6P 0B6**

For ticket &amp; more info:


**Sanjay/Dipti Patel: 647-469-9274 Jignesh/Varsha Patel: 647-575-8420****Jayesh/Rekha Patel: 647-895-0385 Anil/Devayani Patel: 647-746-6423**

૪૮ વર્ષના સાથ અને સહકાર માટે ગુજરાતી ભાઈ-બહેનોનો અશોક ટ્રાવેલ્સ ખૂબજ અભાર માને છે.

**અશોક ટ્રાવેલ્સ ASHOK TRAVELS****416.977.9896 www.ashoktravel.com**

ટોરાન્ટો-કેનેડાની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી

TICO 1486999







હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

 માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી  
 અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણદાણ માણો !!

 રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ,  
 પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આ વિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

આતંકવાદ કે ગુનાખોરીને ડામવાની દીશામાં સુરક્ષા એજન્સીઓને મળશે મોટી મદદ

# ખૂંખાર અપરાધીને ભીડમાં શોધી કાઢતી ટેકનીક્સ

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભાષે દાયકાથી આતંકવાદ એક મોટી સમસ્યા તરીકે સૌને કનડી રહ્યો છે. આ સમસ્યા સામે ભારત જ નહીં, પરંતુ અમેરિકા, આફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, લંડન અને પાકિસ્તાન જેવા દેશો ઝડૂમી રહ્યા છે. યુનોમાં આ મુદ્દે અનેકવાર ચર્ચા થઈ પરંતુ આતંકવાદને નાથવાના પ્રયાસોમાં ઝાઝી સફળતા મળી નથી. જો કે, હવે અનેક દેશમાં આતંકીઓને લાખો લોકોની ભીડમાંથી શોધી કાઢતી ટેકનીક વિકસી રહી છે. ભારતમાં થોડા દિવસ પહેલાં પાંચેક આતંકવાદી પંજાબ બોર્ડરથી પાટનગર દિલ્હીમાં પ્રવેશ્યા હોવાની ખાતમી બોર્ડર સિક્યોરિટી ફોર્સ તરફથી દિલ્હી પોલીસને મળી હતી.

જે બાદ કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી સંરક્ષણ દળોને સાબદા રહેવાની તાકીદ થઈ છે. આ આતંકીઓ છતીસગઢ કે દિલ્હીમાં ત્રાટકી શકે છે. આ ઉપરાંત બીજા ઈન્ટરનશનલ પાકિસ્તાનના 13 લશ્કરી જવાન 'જૈશ-એ-મહમ્મદ'ના નામે જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. એવી માહિતી મળતા જ તેમને શોધી કાઢવા ગુમચર એજન્સીઓ સાબદી થઈ. આવા બનાવો આપણને સામાન્ય રીતે અખબારોમાં વાંચવા અને ટીવી પર જોવા મળે છે. આ જોઈ-સાંભળીને મોટાભાગના લોકોને જિજ્ઞાસા થાય કે, દેશદ્રોહીઓનાં પગે સુરક્ષા એજન્સી કે ગુમચર વિભાગ કરી રીતે શોધી કાઢે છે? કેટલાક દિવસ પહેલાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર બહારગામથી આવેલા મુસાફરોની ભીડમાંથી ચાર શંકાસ્પદ શખ્સોની રેલવે પોલીસે ધરપકડ કરી હતી.

બાદમાં ચારમાંથી ત્રણ જણા આતંકવાદી હોવાના પુરાવા પણ મળ્યા. માત્ર આતંકવાદી જૂથોને જ નહીં, પોલીસને ચોપડે ચઢેલા અને ભાગતા ફરતાં ખૂંખાર- ઉઠાવગીરો- બેન્ક લૂટારુઓને પણ ઝબ્બે કરવામાં હવે સરળતા થઈ ચુકી છે. કારણ કે હજુ સુધી અપરાધીઓની ઓળખ કે એમના ગુનાની કરમકુંડળીને સાચવી રાખવાની પૂરતી વ્યવસ્થા નહોતી. પરંતુ હવે ડિજિટલ ક્ષેત્રે થયેલી નવી શોધખોળ તેમજ 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( AI ) એટલે કે કૃત્રિમ બુદ્ધિની મદદથી એ દિશામાં ઝડપી અને સઘન પ્રયાસ થઈ રહ્યા છે. આતંકવાદીઓને આગોતરા ઓળખી લઈને એમને સમયસર દબોચવા એ કોઈપણ દેશમાં સલામતી માટે પ્રાયોરિટી છે. સામે છેડે આજનો અપરાધી



પણ ગુનાખોરીની લેટેસ્ટ ટેકનિક અને 'મોડસ ઓપરેન્ડી' અપનાવતો થઈ ગયો છે. એટલે એમને સપડાવવાનાં લેટેસ્ટ સાધન-એપ્સ કે પછી સોફ્ટવેર વિકસાવાયા છે.

કોઈ પણ વ્યક્તિની આંખ-કાન-હોઠ-નાક અને વાળ એની ખરી કે ચોક્કસ ઓળખ આપી શકે. આ બધા ઉપરાંત એ વ્યક્તિની હાઈટ-હાથ-પગ-સ્થૂળતા ઈત્યાદિને લીધે આપણી સમક્ષ એનું પૂર્ણ વ્યક્તિત્વ ખડું થાય છે. જો કે પ્રાથમિક ઓળખ માટે એનો ફેસ-ચહેરો કાઢી છે. એ માટે ચહેરાની છબી જરૂરી છે. સારી ક્ષમતાવાળા CCTV કેમેરા દ્વારા

**ઓફબીટ**  
ધવલ શુક્લ

પરંતુ એમની અસ્પષ્ટ તસવીરો અને વીડિયોનું એક સોફ્ટવેરની મદદથી બનેલું ફ્યુઝન (મિશ્રણ-સંયોજન) કરવામાં આવે તો ચોક્કસ સ્થળ-વિસ્તારની પાકી માહિતી મળી શકે. આવી 'મલ્ટી મોડેલ ઈમેજ ફ્યુઝન' ટેકનિક-સોફ્ટવેર તૈયાર કરાયું છે. મુંબઈના પારુલબેન શાહે આ કાર્ય પાર પાડ્યું છે. તેમના દાવા પ્રમાણે રેલવે સ્ટેશન-એરપોર્ટ-જાહેર સભાઓ કે પછી ક્રિકેટ કે ફૂટબોલ મેચ વખતે મોટી સંખ્યામાં દર્શકો ઉમટે છે. આવા સ્થળોમાં 'ફેસ રિકોગ્નિશન સિસ્ટમ'ગોઠવવામાં આવે તો આવી ગીટીમાં

સિસ્ટમ'(VSS) સાથે સાંકળી લેવામાં આવે છે, જે ગીટીમાં ઝડપેલા ચહેરાઓની છબી ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા નિયત કરેલા મુખ્ય મથક - કન્ટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે.

અહીં 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી મળેલી તસવીરોનું પોલીસ ચોપડે નોંધાયેલા અપરાધીઓની છબીઓ સાથે આપોઆપ સરખામણી થાય છે. સાથે જ પૃથક્કરણ થાય અને એમાંથી અપરાધીની છતી થયેલી ઓળખ લાગતી-વળગતી ઈન્ટેલિજન્સ એજન્સીને પહોંચતી કરવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે ધારીએ-વિચારીએ એ કરતાં પણ બહુ ઝડપી હોય છે. ગુનેગારને પારખવાની આ પ્રકારની અતિ આધુનિક વ્યવસ્થા બહુ ટૂંક સમયમાં શરૂ થવાની છે. રેલવે સ્ટેશનો પર લોકોની સૌથી વધુ અવરજવર હોવાથી ખાસ પ્રકારના 400થી વધુ કેમેરા ભારતમાં 750 રેલવે સ્ટેશન પર તબક્કાવાર ગોઠવાશે. પ્રયોગાત્મક સફળતા પછી આમથી મુંબઈના 70થી વધુ લોકલ ટ્રેનનાં સ્ટેશનોનો પણ સમાવેશ થશે. આ 'ફેસ રિકોગ્નિશન સિસ્ટમ'ના કેમેરા માત્ર અપરાધીને જ ઓળખવાના કામમાં નહીં આવે. એના દ્વારા લાપતા બાળકો - વૃદ્ધ વ્યક્તિઓને પણ શોધી શકાશે.

'મલ્ટી મોડેલ ઈમેજ ફ્યુઝન'ટેકનિક પર Ph.D. કર્યું છે એવાં પારુલ શાહે ફિંગર પ્રિન્ટ્સ તેમજ બાયોમેટ્રિક અને આ જ ક્ષેત્રને લગતાં અન્ય વિષયો વિશે સંશોધન કર્યું છે. 'સ્ટેગનોગ્રાફી' એક એવી ટેકનિક છે કે જેમાં ગુમ માહિતીની ઈમેજ વીડિયો-ઓડિયોમાં સંતાડવામાં આવે છે. આ ઉપરાંત 'મલ્ટી મોડેલ ઈમેજ ફ્યુઝન'ટેકનિકનો ઉપયોગ સેટેલાઈટ કેમેરાથી લીધેલી તસવીરો પર પણ થાય છે. સેટેલાઈટથી ઝડપાયેલી હજારો તસવીરોમાંથી ફ્યુઝન ટેકનિક દ્વારા જોઈતી 8-10 તસવીરો તારવીને એક ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકાય છે. એ જ રીતે, તબીબી ક્ષેત્રે પણ આ સોફ્ટવેર ટેકનિકની મદદથી CT સ્કેન તેમજ MRIની ઈમેજનું ફ્યુઝન-સંમિશ્રણ કરીને યોગ્ય નિદાન ઉપર પહોંચી શકાય છે.

આવાં નિદાન અટપટાં ઓપરેશન વખતે ખાસ કામ લાગે છે. તાજેતરનું એક વિશ્વવ્યાપી સર્વેક્ષણનું તારણ કહે છે કે આગામી 2 વર્ષ એટલે કે 2024 સુધીમાં 'ફેસલ રિકોગ્નિશન'ની માર્કેટ 7 અબજ ડોલરનો આંક વળોટી જશે!

**આજનો અપરાધી લેટેસ્ટ ટેકનિક અપનાવતો થઈ જતા સુરક્ષા એજન્સીએ અદ્યતન સાધન-એપ્સ કે પછી સોફ્ટવેરનો ઉપયોગ કરવા માંડ્યો. સીસીટીવીએ લીધેલી તસવીર સંગ્રહીત ડેટા સાથે આપોઆપ મેચ થવા માંડે છે**

આવી તસવીર ઝડપી લેવામાં આવે તે પછી એની ઓળખ માટેના વિભિન્ન તબક્કા છે. જાણીને નવાઈ લાગે પરંતુ થોડાં વર્ષ અગાઉ આ દિશામાં મહત્વનું પ્રદાન કર્યું હતું. અત્યાર સુધીની સિસ્ટમમાં ગાઢ જંગલમાં ઈન્ફ્રારેડ કેમેરામાં ગુનેગારની તસવીર કેદ થતી હતી. પરંતુ ઓછા પ્રકાશવાળા સ્થળે હાજર તે શખ્સની બરાબર ઓળખ કરવું મુશ્કેલ હતું.

બીજાની સાથે ભળી ગયેલા ગુનેગારોના ચહેરા પણ ઝડપાય જાય તેમ છે. તે પછી પોલીસ ચોપડે જે ગુનેગારોની માહિતી અગાઉથી રાખવામાં આવી હોય એની સાથે સરખાવવામાં આવે તો ભીડમાં ભળી ગયેલા અપરાધીની ઓળખ તરત થઈ જાય. જાહેર સ્થળોએ ગોઠવવામાં આવેલા 'ક્લોઝ સર્કિટ ટીવી નેટવર્ક'ને 'વીડિયો સર્વેલન્સ



# RapperBot માલવેર

એક નવું IoT બોટનેટ માલવેર જેને RapperBot તરીકે જૂન 2022 ના મધ્યમાં પ્રથમ વખત ઝડપથી વિકસિત કરતું જોવામાં આવ્યું છે. જેની ક્ષમતાઓ અન્ય માલવેર કરતા વિપરીત છે. આ માલવેર મિરાઈ સોર્સ કોડની મદદ થી બ્રુટ ફોર્સ કરવા માટે સક્ષમ છે. જેથી ટેલનેટને બદલે SSH સર્વિસની એક્સેસ મેળવવાની ક્ષમતા ધરાવે છે.



RapperBot માલવેર જેનું નામ એમ્બોડેડ યુઆરએલ પરથી યુટ્યુબ રેપ મ્યુઝિક વિડિયોને અગાઉના વર્ગનમાં મળે છે. એવું કહેવાય છે કે તેણે એટેક કરેલા SSH સર્વિસનો વધતો સંગ્રહ એકત્રિત કર્યો છે. જેમાં 3,500 થી વધુ IP એડ્રેસનો ઉપયોગ સ્કેન કરવા અને તેમના માર્ગને બ્રુટ-ફોર્સ કરવા માટે થાય છે. RapperBot માલવેરનું વર્તમાન અમલીકરણ તેને મિરાઈ સોર્સ કોડ સાથે દર્શાવે છે. જે તેને મુખ્યત્વે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) એટેક કરવા માટે મર્યાદિત ક્ષમતાઓ સાથે SSH બ્રુટ-ફોર્સ ટૂલ તરીકે કાર્ય કરવાની મંજૂરી આપે છે.

માલવેર ઈન્સ્ટોલ કરવામાં આવે છે. જે સર્વર રીસ્ટાર્ટ થયા બાદ પણ લાંબા સમય સુધી એક્સેસ જાળવી રાખે છે. એટેક્સમાં રિમોટ સર્વરથી પ્રાપ્ત થયેલ ઓળખપત્રોની સૂચિનો ઉપયોગ કરીને સંભવિત લક્ષ્યોને ઘાતકી દબાણ કરવામાં આવે છે. નબળા SSH સર્વરમાં સફળતાપૂર્વક તોડવા અને માન્ય ઓળખપત્રો ક્રમાન્ડ-એન્ડ-કંટ્રોલ સાથે પાછા ફરે છે.

બ્રુટ-ફોર્સ SSH સર્વિસમાં રિમોટ એક્સેસ જાળવી રાખવા માટે સ્વિચ કર્યું છે. “~/.ssh/authorized\_keys” નામની વિશિષ્ટ ફાઈલમાં ઓપરેટર્સની SSH પબ્લિક કી ઉમેરીને એક્સેસ મેળવવામાં આવે છે. જે એટેકરને પાસવર્ડ આપ્યા વિના સંબંધિત ખાનગી કીનો ઉપયોગ કરીને સર્વર સાથે કનેક્ટ અને પ્રમાણિત કરવાની પરવાનગી આપે છે.

સંશોધકો જણાવે છે કે એક વાર SSH સર્વરનો એક્સેસ મળી ગયા બાદ હેક્સ SSH સર્વરનો પાસવર્ડ બદલી નાખે છે જેથી તેઓ વારંવાર સર્વરનો એક્સેસ મેળવી શકે. વધુમાં તેઓએ ફાઈલ બદલી નાખી હોવાથી એડમીન દ્વારા બધી અધિકૃત કરેલ કી ને કાઢી નાખવામાં તેઓ સક્ષમ છે. જેથી યુઝર્સ પબ્લિક કી ને પ્રમાણીકરણ કરી SSH સર્વરનો એક્સેસ મેળવી શકતો નથી.

હેક્સ દ્વારા આ સંપૂર્ણ પ્રક્રિયા થઈ ગયા બાદ તેઓ DDoS એટેકની તૈયારી કરે છે જેથી સર્વર સંપૂર્ણપણે નાશ પામે અને તે કોઈ પ્રતિક્રિયા ન આપે.

સંશોધકોએ જણાવ્યું હતું કે જુલાઈના મધ્યભાગથી, RapperBot સ્વ-પ્રચારથી

beinghumanmj

## બોડી મુજબ સ્ટ્રાઈપ્સ સ્ટાઈલ કરીને સ્ટાઈલિશ લુક મેળવો

ફેશનની દુનિયામાં નિતનવું પરિવર્તન આવતું જ રહે છે, ક્યારેક જૂની ફેશનને નવાં રૂપરંગ સાથે રજૂ કરવામાં આવે છે. એમાં સ્ટ્રાઈપ્સનો સમાવેશ કરી શકાય. ફેશનની દુનિયામાં સ્ટ્રાઈપ્સ હંમેશાં લોકપ્રિય રહી છે. આ બોલ્ડ હોય છે, રૂમેટિક હોય છે, લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ સાથે તમને સ્ટાઈલિશ પણ રાખે છે. ખાસ વાત એ છે કે આ દરેક બોડીટાઈપ પર સૂટ કરે છે. તમે તમારા લુકને સિમ્પલ અને એલિગન્ટની સાથે સ્ટાઈલિશ પણ રાખવા ઇચ્છો છો તો સ્ટ્રાઈપ્સ તમારી મદદ કરશે. ખાસ વાત એ છે કે સ્ટ્રાઈપ્સ ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતી. સ્ટ્રાઈપ્સની સાથે માર્કેટમાં કંઈક ને કંઈક એક્સપરિમેન્ટ થતાં રહે છે અને તે ટ્રેન્ડમાં રહે છે. જાડી અને પાતળી સ્ટ્રાઈપ્સનું કોસ્મિનેશન તમને પ્લેકુલ લુક આપે છે. સ્ટ્રાઈપ્સની સિમ્પલ પેટર્ન આજકાલ સેલિબ્રિટીઝની પણ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે.

સ્ટ્રાઈપવાળું સ્કર્ટ પહેરી શકો છો. એની સાથે રાઉન્ડ નેકવાળું ટી શર્ટ કેરી કરી શકો છો. જો તમારું ફિગર સ્ટ્રેટ હોય તો એ લાઈન નોટિકલ ડ્રેસ પહેરો. રફ્સવાળો ડ્રેસ વધારે સારો લાગશે.

### ડાયગ્નલ સ્ટ્રાઈપ

તમે ઇચ્છો તો સ્ટ્રાઈપની સાથે પોલ્કા ડોટ્સ, ફ્લોરલ વગેરે પણ મેચ કરી શકો છો. ટ્યૂનિક્, સ્વિમવેર કે કુરતામાં તમે ડાયગ્નલ સ્ટ્રાઈપ્સ પહેરી શકો છો. એમાં તમે સ્લિમ દેખાશો. તમારી હાઈટ પ્રમાણે બ્રોડ પેચીઝ કે થિન લાઈન્સવાળો ડ્રેસ પણ પહેરી શકો છો.

### સ્કર્ટ શોર્ટ

સ્કર્ટમાં સ્ટ્રાઈપ્સની સાથે એક્સપરિમેન્ટ કરવા ઇચ્છો છો તો ડાર્ક કલરના ઓપ્શન્સ પર જાવ. એ લાઈન સ્કર્ટમાં બ્લેક એન્ડ વાઈટ નેવી બ્લુ એન્ડ વ્હાઈટ, ગ્રીન એન્ડ યલો અને પિંકના પેસ્ટલ શેડ્સના સ્ટ્રાઈપ્સ તમને ચિક લુક આપશે. આ સિવાય સ્ટ્રાઈપવાળા શોર્ટ્સની સાથે ચંકી નેકપીસ પણ ફૂલ લુક આપશે. બીજી એક્સેસરીઝની વાત કરીએ તો હોરિજન્ટ સ્ટ્રાઈપ્સવાળી બેગ ડિફરન્ટ લાગશે. સ્ટ્રાઈપ્સ પેન્ટનો ટ્રેન્ડ ઈન્ટરનેશનલ લેવલ પર હિટ છે. જેમની હાઈટ ઓછી છે તેમને આ પેન્ટ્સ પર્સનાલિટીને વધારે ફેવર કરે છે.

### ઇવનિંગ લુક

ઈવનિંગમાં ફૂલ લુક માટે ડેનિમની જગ્યાએ સ્ટ્રાઈપ ટ્રાઉઝર્સ પહેરો. જોકે આમાં પણ તમારે તમારા બોડી ટાઈપનું ધ્યાન રાખવું પડશે. આ ટ્રાઉઝર્સની સાથે ફોર્મલ કે ઈનફોર્મલ શર્ટનું સિલેક્શન તમે ઓકેઝન અનુસાર કરી શકો છો.

### બોડી ટાઈપ

સ્ટ્રાઈપ્સને જો બોડી ટાઈપ અનુસાર પહેરવામાં આવે તો એ વધારે અપીલિંગ લાગે છે. આમ તો હોરિજન્ટલ સ્ટ્રાઈપ્સ પહેરવાનું યુવતીઓ અવોઈડ કરે છે, કારણ કે એનાથી બોડી શેપ બ્રોડ લાગે છે. જોકે તેને સ્માર્ટ રીતે કેરી કરવામાં આવે તો એ વધુ સારી લાગશે. તમારું ફિગર ઓવરગલાસ શેપનું છે તો તમે નોટિકલ સ્ટ્રાઈપવાળા ટી શર્ટને ડાર્ક ડેનિમની સાથે પેર કરી શકો છો.

આ ઉપરાંત પ્લેન ટી શર્ટ કે શર્ટની સાથે નોટિકલ ટ્રાઉઝર્સ પહેરી શકો છો. તમારો બસ્ટ એરિયા હેવી હોય તો બોડીના લોઅર હાફમાં સ્ટ્રાઈપ પહેરી શકો છો. તમે નોટિકલ



## અપનાવી જુઓ

■ મુખમાંના છાલાથી રાહત પામવા દિવસમાં વારંવાર મીઠાના પાણીથી કોગળા કરવા. ■ ઘરનું દહીં અને સંતરાના રસનું મિશ્રણ વાનને નિખારે છે. પાણીની છાલક માંથી ચહેરો સાફ કરવો. એક ચમચો દહીં અને સંતરાનો રસનું મિશ્રણ લગાડવું. સુકાઈ જાય બાદ ઘોંઘ નાખવું. ■ એક ચમચો તાજુ દહીં, મધ અને લીંબુનો રસ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવી સુકાઈ જાય બાદ ઘોંઘ નાખવું. આ પેસ્ટ સ્કિન વ્હાઈટનિંગનું કામ કરે છે. ■ એક ચમચી ચંદન પાવડર, લીંબુનો તથા ટામેટાનો તાજો રસ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવાથી વાન નિખારે છે. ■ વેફરને કિસ્પી બનાવતા પહેલા તેના પર મીઠાવાળુ પાણી છાંટવું.

શીર્ષક : ખજૂરાહો  
મૂળ કવિ : પારમિતા  
અનુવાદ : હિના મોદી

મારા હાડપિંજર પર ચોટેલી છે  
કવિતાઓની એક જૂની હસ્તપ્રત,  
જેમાં મેં લખી છે;  
વૃક્ષની કેશવાણીમાં  
ફસાયેલ તારાઓની વાર્તા.  
સપનાંઓ અને ઘચ્છાઓમાં  
લથડિયાં ખાતી વફાદારીઓ સમેત  
મૃત્યુ પામેલા પ્રેમની શોધમાં  
ખજૂરાહોની અણસમજુ નર્તકીઓ  
નજર નથી મેળવી શકતી પોતાની જાત  
સાથે.

કેવી રીતે સમજાવું એમને?  
આ ગુફાનાં સંગીત અને અંધકાર વચ્ચે  
સમયે મારી સાથે પણ છળ કર્યું છે!  
સાંજથી જ ઉડવા લાગેલી  
મુઠીભર ધૂળ  
મોડી રાત સુધી ...  
કશુંક ગણાગણે છે  
મેં એમને સાંભળી લીધી છે.  
તે એક સવાલ હતો,  
'શું કોઈ પુરુષે ક્યારેય આપી છે  
અગ્નિપરીક્ષા ?'

પથ્થરોમાં લપેટાયેલ  
અસંખ્ય સ્વપ્નો તડપે છે,  
તડપે છે એક ગણકાર માટે  
પોતાના અસ્તિત્વને સાબિત કરવા માટે  
જોઈ રહે છે મને  
ટીકીટીકીને...  
હા, એ સાચું તો છે,  
પ્રાણ હોય કે નિખાણ  
નારીએ જ શોધવી પડે છે  
પોતાની અસ્મિતા .  
પરંતુ, હું તો છું એક અવશેષ  
ઘટિલાસનાં ખંડેરોમાં -  
કેવી રીતે કહું તને - ભાષા સિવાય  
બીજું કોઈ હથિયાર નથી  
મારી પાસે.

## Sri Radha Krishna Temple

1960 Ellesmere Road Unit 9 Scarborough ON M1H 2V9  
srkt2000@gmail.com 416-431-3311 www.sriradhakrishnatemple.ca

Sunday Sep 10, 2022

### Srimad Bhagvad Gita Pravachan

6:15pm-7:00pm  
Aarti followed by Prasad



Monday Sep 11, 2022

### Shiv Aradhana

6:15pm-7:00pm

### Havan

7:00pm-7:30pm

Aarti followed by Prasad



For Sponsorship please contact 416-431-3311



# કોન્સ્ટેબલ પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે ૧૨ માળેથી કુદી આત્મહત્યા કરી

દંપતિ વચ્ચે ચાલતા ઝઘડાનો કડણ અંજામ: સુસાઈડ નોટથી પોલીસ ખાતા સામે પણ સવાલો ઉઠ્યા

અમદાવાદ

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની એકાઉન્ટ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવ ગોતામાં આવેલા દિવા હાઈટ્સમાં બારમાં માળે તેમના પત્ની રીદ્દી અને ત્રણ વર્ષની દીકરી આકાંક્ષા સાથે રહેતા હતા. મંગળવારે રાતના સમયે તેમના વચ્ચે દંપતિ વચ્ચે તકરાર થઈ હતી. જે બાદ રાતના સવા એક વાગ્યાની આસપાસ તેની રીધ્ધીએ બારમાં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. જેના થોડા મિનિટ બાદ

કુલદીપસિંહ યાદવે તેની ત્રણ વર્ષની દીકરી આકાંક્ષાને ગળા લગાડીને ૧૨ માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઉપરાંત, ૧૨ માળે રહેતા કુલદીપના બહેન પાડલબેનને બોલાવવામાં આવ્યા હતા. જેઓ તેમના ભાઈ, ભાભી અને ત્રણ વર્ષની દીકરીના મૃતદેહને જોઈને ભાંગી પડ્યા હતા. આ અંગે સોલા પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ

કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા કુલદીપસિંહ પરિવાર સાથે દિવા હાઈટ્સમાં રહેવા માટે આવ્યા હતા. કુલદીપસિંહને તેની પત્ની વચ્ચે અનેકવાર કોઈ કારણસર તકરાર પણ થતી હતી. જેના કારણે ઘરનું વાતાવરણ તંગ રહેતું હતું. જે બાબતની જાણ કુલદીપના બહેનને પણ હતી. જો કે તે પારિવારિક તકરારમાં અનેકવાર સમાધાન કરાવી ચુક્યા હતા. પોલીસે કુલદીપસિંહનો મોબાઈલ ફોન તપાસ્યો હતો. મૃતકની સુસાઈડ નોટથી પોલીસ અધિકારી સામે પણ સવાલો ઉઠ્યા છે.

# ઉદ્યોગોને ટેકનોલોજી સજ્જ કરવા ઇન્ડો-અમેરિકન ચેમ્બર વચ્ચે કરાર

કોમ્પ્યુટરની મદદથી ઉત્પાદન વધારવા માર્ગદર્શન અપાશે

અમદાવાદ

નાના અને મધ્યમ ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા અને તેની તાલીમ આપીને તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કરવા માટે નાસકોમ સેન્ટર ઓફ એક્સિલન્સ અને ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સે કરાર કર્યા છે. નાના મેન્યુફેક્ચરિંગની ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ટેકનોલોજી અને કોમ્પ્યુટરના સમન્વયથી તમના ઉત્પાદન એકમોની ક્ષમતામાં સુધારો કરવા માટે તેમને માર્ગદર્શન આપવાનું



કામ કરશે. આ કરાર હેઠળ તેમના સભ્યોને તાલીમ આપવાનું કામ પણ કરવામાં આવશે. પ્રોડક્ટના ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

# ભારતે દરેક દેશના હિતને પ્રાથમિકતા આપવી પડશે : મંત્રી એસ. જયશંકર

અમદાવાદ

આઝાદી સમયે દેશનું વિભાજન, આર્થિક સુધારણામાં લગભગ 15 વર્ષ જેટલું મોડું થવું અને પરમાણુ શક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં વિલંબ આ ત્રણ એવી ચીજો છે કે જેની દેશના સામાજિક અને આર્થિક વિકાસ ઉપર અસર થઈ છે અને તેનાથી દેશને નુકસાન થયું છે, એમ દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમદાવાદ ખાતે જણાવ્યું હતું. પુસ્તક ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર અનસર્વેન વર્લ્ડના ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આ વાત કરી હતી. “ભારત માટે ચીન એક સુપર પાડોશી છે. માત્ર સરહદ નહીં પણ

આર્થિક રીતે પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આર્થિક વિકાસમાં ભારત અને ચીનની સરખામણી થતી આવી રહી છે. પણ મારું માનવું છે કે ભારત કરતા ચીનમાં આર્થિક સુધારણા પહેલા શરૂ થઈ હતી. ભારતે આ માટે બીજા 15 વર્ષ જેટલો સમય લીધો. બીજું, ચીનના આર્થિક સુધારા વધારે વ્યાપક હતા એટલે પણ ભારત તેના કરતા પાછળ રહી ગયું છે,” એમ જયશંકરે જણાવ્યું હતું. એસ. જયશંકરે ભારત સરકારમાં 38 વર્ષ સુધી ડીપ્લોમેટ તરીકે, દેશના ચીન, સિંગાપોર, અમેરિકા અને જાપાન તરીકેના રાજદૂત તરીકે અને નિવૃત્તિ પહેલા દેશના વિદેશ સચિવ તરીકે ફરજ બજાવી હતી.

# બહુચરાજી મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે: ટ્રસ્ટી મંડળનો મહત્વનો નિર્ણય

મહેસાણા

શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિવેલવ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવું નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં



આવશે. બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસરની આજુબાજુનો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર

કરવામાં આવશે. મંદિર પરિસરમાં એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજી સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવામાં આવશે. નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી રંગે રંગે માતાજીના પરિસરમાં ઉજવવામાં આવશેવૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે લીલચેર અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે, દર્શનમાં પણ તેમને અગ્રીમતા આપવામાં આવશે મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવનું બ્યુટીફિકેશન કરાશે.

# ગુજરાતમાં સિઝનનો ૧૦૨ ટકા વરસાદ જળાશયોમાં ૮૧ ટકા જળસંગ્રહ થઈ ગયો

અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થવાની આગાહી

અમદાવાદ

ગુજરાતમાં ૩૪ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૦૨ ટકા વરસાદ નોંધાય ચૂક્યો છે. ૨૦૬ જળાશયોમાં ૮૧.૨૬ ટકા અને સરદાર સરોવર જળાશયમાં ૮૪.૭૦ ટકા જળસંગ્રહ છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ

તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ‘ આ ઉપરાંત આવતીકાલે બનાસકાંઠા- સાબરકાંઠા- મહેસાણા-પાટણ-અમરેલી- ગીર સોમનાથ-ભાવનગરમાં, શનિવારે નવસારી-ડાંગ-અમદાવાદ-ગાંધીનગર- આણંદ-ખેડા-મહીસાગર-પંચમહાલ- અમરેલી-ભાવનગર-બોટાદ-જુનાગઢ- રાજકોટ-પોરબંદર-સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અધિકારીઓના

મતે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૮૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઈ એલર્ટ પર, કુલ ૨૩ જળાશય એલર્ટ પર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ પર છે.

# વલસાડની સિંગર વૈશાલીની હત્યા કેસમાં કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ

વલસાડ

વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ ૨૮મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વૈશાલી બલસારાની હત્યાનું રહસ્ય ઉકેલવા દીમો બનાવી હતી. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના ૧૦૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા હતા. આખરે વૈશાલી બલસારાની હત્યાના રહસ્ય પરથી પડદો ઉચકવામાં

પોલીસને સફળતા મળી હતી. પોલીસે વૈશાલીની હત્યાની માસ્ટર માઈન્ડ મૃતક વૈશાલીની જ નજીકની મિત્ર બંધીતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંધીતાએ વૈશાલીની હત્યા માટે બહારના રાજ્યના એક પ્રોફેશનલ કિલર ગેંગનો સંપર્ક કર્યો હતો. તપાસમાં ચોકાવનારો બુલાસો થયો હતો. જે બાદ પોલીસે કોન્ટ્રાક્ટ કિલરને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. વલસાડ એલસીબીની ટીમે પંજાબથી સુખવિંદર નામના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે.

# જળમાર્ગે કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત, ઘોઘાથી નવી શિપની પ્રથમ ટ્રીપ શરૂ

ભાવનગર

ભાવનગર અને સુરત વચ્ચે છેલ્લા દોઢેક માસથી ખોરવાયેલી જળમાર્ગની કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થઈ છે. બુધવારથી ઘોઘા-હજીરા વચ્ચે વધુ સુવિધાઓથી સજ્જ નવું વોયેજ એક્સપ્રેસ જહાજ ઘોઘાથી પ્રથમ ટ્રીપ સાથે જ રો-પેક્સ ફેરી સર્વિસને પુનઃ શરૂ કરાઈ હતી. જૂનું જહાજ હજુ મેઈન્ટેનન્સમાં જ હોવાથી હાલ બન્ને દિશાએ એક-એક ફેરો કરવામાં આવશે. રિપેરીંગમાંથી આવ્યા બાદ નાગરિકોને બે રાઉન્ડ ટ્રીપની સુવિધાનો લાભ મળશે. ઘોઘા-હજીરા વચ્ચે વોયેજ સિમ્ફની જહાજથી રો-પેક્સ ફેરી સર્વિસનું સંચાલન થતું હતું. પરંતુ શિપમાં રિપેરીંગ કામની જરૂરિયાત ઉભી થતાં જુલાઈથી સેવા બંધ હતી.

# સરકારે માગણીઓ પ્રત્યે પૂરતું ધ્યાન ન આપતા કિસાન સંઘનું એલાન ખેડતો વિફર્યા : CM, નાણામંત્રી સહિત 7 મંત્રીઓના ઘર આંગણે ઘરણાં કરાશે

અમદાવાદ

સમાન કૃષિ વીજ દર સહિત ખેતી, પશુપાલન સંબંધિત વર્ષો જૂની 26 માંગણીઓ મુદ્દે 14 દિવસથી અહીના સેન્ટ્રલ વિસ્તા- સ્વર્ણિમ પાર્કમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એમ છતાંયે ગુજરાત સરકારે તેમની રજૂઆતોના ઉકેલા માટે આગેવાનો સાથે બેઠક સુધ્ધા યોજી નથી. આથી, ભારતીય કિસાન સંઘ બરોબરનો અકળાયો છે અને આગેવાનોએ મંગળવારે મુખ્યમંત્રી, નાણા મંત્રી સહિત

7 મંત્રીઓના ઘરની આગળ જ વિરોધ પ્રદર્શન, ધરણાં યોજવા જિલ્લા સંગઠનોને એલાન આપ્યું છે. કિસાન સંઘના સહ પ્રચાર પ્રમુખ મનસુખ પટોળિયા અને આર.કે.પટેલ સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને હૈયાવરાળ ઠાલવી હતી. તેમણે કહ્યું કે, અમારી માંગણીઓ આજની નથી. પરંતુ, ડિઝલ અને વીજ, પાણીદરમાં વધારા પછી એ વર્ષો જૂના પ્રશ્નો ખેતી અને પશુપાલન ઉપર જબજસ્ત ભારણ સર્જી રહ્યા છે.

# 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે: વાઘાણી

ગાંધીનગર

જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.21 અને 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત રૂ.3300 કરોડના કુલ 20 હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુદૂર્ત કરવામાં આવનાર છે. તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. મંત્રી વાઘાણીએ સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિવિધ સેવાઓ ઘર આંગણે મળી રહે તે આશયથી સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે.



# કોંગ્રેસની સરકાર રચાશે તો ખેડૂતોનું દેવુ માફ : રાહુલ

અમદાવાદ આવેલા અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધ્યું: ભાજપ સરકાર પર આકરા પ્રહારો

**અમદાવાદ**

કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રાના આરંભ અગાઉ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાકે, એક બાજુ, સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવે છેને બીજી બાજુ, એ જ સરદારની વિચારધારા પર આક્રમણ કરવામાં આવે છે.એ વિચારધારાનું અપમાન કરાય છે.

રાહુલ ગાંધીએ પણ વાયદો કર્યો હતોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, ખેડૂતોનું

**કોંગ્રેસમાં ટોળાં સાથે દાવેદારી કરનાર હવેથી ટિકિટ માટે લાયક નહીં ગણાય**

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ કોંગ્રેસે કસરત શરૂ કરી છે ત્યાં સ્ક્રિનિંગ કમિટીએ એવો નિર્ણય કર્યો છે કે, જો કોઈ દાવેદાર ટોળાં સાથે ટિકિટની રજૂઆત કરવા આવશે તો તેને ટિકિટ માટે લાયક ગણવામાં નહિ આવે. બીજી તરફ કોઈ દાવેદારને ટિકિટ ના મળે ત્યાં હેંગામો મચતો હોય છે, આવા અસંતુષ્ટોને મનાવવા માટે તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સ્ક્રિનિંગ કમિટી બનાવવામાં આવશે, જે સમજાવટનું કામ કરશે. આ વખતે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાતમાં થશે, સ્ક્રિનિંગ કમિટીની બેઠક ગુજરાતમાં જ મળશે, ટિકિટની રજૂઆત માટે કોઈને દિલ્હીના આંટા મારવાની જરૂર નહિ પડે તેવું પણ કોંગ્રેસે જાહેર કર્યું છે.

ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરાશે. કાર્યકરોને રાહુલ ગાંધીએ જીતનો મંત્ર આપ્યોકે, ટિકરીઓને મફત શિક્ષણ અપાશે જયારે ૩૦૦ ગુજરાતની જનતા આજે ત્રસ્ત બની ગઈ છે. જો યુનિટ વીજળી મફત અપાશે. આ ઉપરાંત બુધ પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ ધરીને લડાયક બનીને

ચૂંટણી લડશે તો કોંગ્રેસની સરકાર નક્કી છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું કે, ગુજરાત આજે ડ્રગ્સનું સેન્ટર બન્યું છે. કોઈ સામાન્ય વ્યક્તિ પાસે ડ્રગ્સ પકડાય તો કાર્યવાહી થાય છે પણ મુંદ્રા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાય તો પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ઉદ્યોગપતિઓને હજારો એકર જમીનોની હાણી કરી દેવાય છે જયારે ગરીબ આદિવાસી તેના હકની જમીન માંગે તો તેને મળતી નથી. લોકતંત્ર પર જ નહીં, ગુજરાતની જનતા પર આક્રમણ થઈ રહ્યું છે પણ કોઈ બોલી શકતું નથી. ગુજરાત માત્ર એવું રાજ્ય છે જ્યાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે.

## આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે વધુ 10 નામ જાહેર કર્યા

**અમદાવાદ**

AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે અને આગામી ચૂંટણી બહુમતી સાથે જીતીશું. આમ આદમી પાર્ટી 2022ના અંતે યોજનારી

સંભવિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. નવા જાહેર કરેલા ઉમેદવારના નામમાં કેલાસ ગઢવી - માંડવી કચ્છ, દિનેશ કાપડિયા - દાણીલીમડ, ડૉ. રમેશ પટેલ- ડીસા, લલેશ ઠક્કર- પાટણ, કલ્પેશ પટેલ - વેજલપુર બેઠક, વિજય ચાવડા - સાવલી, બીપીન ગામેતી - ખેડબ્રહ્મા, પ્રફુલ વસાવા - નાંદોદ, જીવન જીંગુ - પોરબંદર, અરવિંદ ગામીત (નીઝર)નો સમાવેશ થાય છે.

## નરેન્દ્ર-ભુપેન્દ્રની સરકાર લોકો માટે કામ કરે છે, વ્યૈટિયા નીકળી ગયા : વડાપ્રધાન

ઓલપાડમાં વિવિધ યોજનાના લાભાર્થીના કાર્યક્રમમાં વડાપ્રધાન વચ્ચેઅલી જોડાયા

**સુરત**

ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાના લાભાર્થીઓની કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા. તેઓએ ભુપેન્દ્ર-નરેન્દ્રની સરકાર લોકો માટે કામ કરી રહી છે. અને હજારો અને લાખો લોકોને સીધો લાભ મળી રહ્યો છે અને વ્યૈટિયાઓ નીકળી ગયા છે. આ ઉપરાંત તેઓએ કેટલાક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. જે લોકો લાભ લઈ રહ્યા છે

અને જે અન્ય લોકોને પણ આ લાભ મળે તે માટે કામગીરી કરવા કહ્યું હતું સભામાં વચ્ચેઅલ જોડાયેલા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, સુરતમાં એક રીતે ડબલ એન્જિન સરકાર એટલે ભુપેન્દ્ર નરેન્દ્ર સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓના દર્શન કરવા એ અમારા માટે સૌભાગ્યની વાત છે. ઓલપાડમાં જે રીતે આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અહીં એક સાથે હજારો લોકોના નિદાન કરીને તેમની વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે કાર્યક્રમમાં ભુપેન્દ્ર ભાઈની ગુજરાત સરકાર અને સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપનું સંગઠન કામ કરી રહ્યું છે. આ જ સેવા ભાવ આ જ સદ્ભાવના તે ગુજરાતની પ્રજાના સતત આર્શિવાદ ના કારણે શક્ય બની રહી છે. સુરતના લોકોના આવી સદ્ભાવના કાયમ માટે જોવા મળે છે. સુરતીઓ હંમેશા સદ્ભાવના અને સામર્થ્ય રાખે છે તેના કારણે સુરત મીની ભારત બની રહ્યું છે

## ચૂંટણીમાં ઉતરતા પહેલાં સરકાર એક લાખ યુવાનોને રોજગારી પત્રો આપશે

સરકારી નોકરી, કોર્પોરેટ- ઉદ્યોગગૃહ માટે મોદીના જન્મ દિવસથી પત્રનું વિતરણ થશે

ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરતા પહેલા રાજ્યની ભાજપ સરકાર એક લાખ બેરોજગાર યુવાનોને રોજગારી પત્ર આપવા તખ્તો તૈયાર કરી રહી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મંગળવારે આટલી મોટી સંખ્યામાં ક્યાં ક્યાં નોકરી આપી શકાય તેના માટે બેઠક મળી હતી. જેમાં 12 વિભાગોના સેક્રેટરીઓએ આંકડા રજૂ કર્યાનું જાણવા મળ્યું છે.



પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતીમા ત્રણ બોર્ડ સહિત અનેક

સરકારી, અર્ધ સરકારી અને બોર્ડ-કોર્પોરેશનમાં કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે અઢી વર્ષથી નવી ભરતીઓ અટકી પડી છે. આ તમામ ભરતી સંસ્થાઓમાં 30 હજાર જેટલી ભરતી પ્રક્રિયા પાર્થપ લાઈનમાં છે. જેમાં અંતિમ તબક્કે અર્થાત માત્ર નિમણૂક પત્રો આપવાના બાકી હોય તેવી તમામ ભરતીઓને નવરાત્રિ પહેલા ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે.

## જવાનના ઘરે કુરીયરથી મોકલાયેલો શોર્ય ચક્ર તેના પરિવારે સ્વીકાર્યો નહીં

**અમદાવાદ**

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા અમદાવાદના જવાનના ઘરે કુરીયરથી મોકલવામાં આવેલા શોર્ય ચક્રને તેમના માતાપિતાએ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હોય છે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે શોર્ય ચક્ર એનાયત કરવામાં આવતું હોય છે, તેના બદલે તેને કુરીયરથી મોકલી દેવાતા શહીદના માતાપિતા નારાજ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ગોપાલ સિંહ ફેબ્રુઆરી ૨૦૧૭માં શહીદ થયા હતા. જે સમ્માન રાષ્ટ્રપતિ ભવનમાં મળવું જોઈતું હતું તેને આ રીતે

મોકલી દેવાતા શહીદના પિતા મુનિમસિંહ ભટ્ટારિયાએ ના માત્ર તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે, પરંતુ આ મામલે રાષ્ટ્રપતિ ભવનને દબલગીરી કરવા માટે પણ વિનંતી કરી છે. શહીદ ગોપાલ સિંહના સર્વિસ બેનિફિટ્સ અને અવોર્ડ માટે તેમના માતાપિતા અને પત્ની વચ્ચે કાયદાકીય જંગ પણ થયો હતો. ૨૦૧૧માં શહીદની પત્ની તેમનાથી અલગ થઈ ગઈ હતી, પરંતુ તેમના કાયદેસરના છૂટાછેડા નહોતા થયા. નિયમ પ્રમાણે શહીદની પત્ની બેનિફિટ્સ મેળવવાને પાત્ર હતી, પરંતુ ગોપાલ સિંહના માતાપિતાએ કોર્ટમાં કેસ

## ગુજરાતમાં 130 સ્થળે ITના દરોડાનો ધમધમાટ

ઈલેક્શન કમિશન પાસેથી પુરાવાઓ મળતાં અબજોનું મની લૉન્ડરિંગ પકડાવાની શક્યતા

**અમદાવાદ**

રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓ અને તેમને ડોનેશન આપનારા વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓને અમદાવાદના ૮૦ લોકેશન સહિત અમદાવાદના ૮૦ સહિત ગુજરાતના ૧૩૦ જેટલા સ્થળો પર આવકવેરા ખાતાઓ આજે સવારથી દરોડા પાડયા છે. એન્ડ્રી પ્રોવાઈડર્સ તથા અમદાવાદની એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ સિલ્વર ઓક સાથે સંકળાયેલા શીતલ

અગ્રવાલ તથા તેમની સંસ્થાના અન્ય ત્રણ ડિરેક્ટર્સને પણ કવર કરવામાંઆવ્યા હોવાની શક્યતાને નકારી શકાતી નથી. તેના ઇંટા રાજસ્થાન હોસ્પિટલ પર પણ ઊડી શકે છે. બીજીતરફ શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના ઈન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલી ગોલ્ડમાઈન સિક્યોરિટીઝના કિરીટ વાસ્સા, રમેશ મહેતા, જયશ્રી રમેશ પટેલ, સમીર પંકજભાઈ ગાંધીનો સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તેમની ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસમાં પણ આવકવેરા ખાતાએ સર્ચ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનમાં ૫૪ અને મધ્ય પ્રદેશમાં એક સ્થળે દરોડા પડવામાં આવ્યા હતા. દરોડા હેઠળ આવરી લેવામાં આવતી હોવાનું મનાતી પાંચ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઓમાં શ્રી ભારત વિકાસ પક્ષ, ગરવી ગુજરાત, જન સેવા પાર્ટી, ગુજરાત યુવા વિકાસ પાર્ટી, મહાગુજરાત જનતા પાર્ટી,

યુવા જાગૃતિ દળનો સમાવેશ થાય છે. આ પાર્ટીઓને ડોનેશન આપીને અબજો રૂપિયાનું મની લૉન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મંગળવારે દરોડા દરમિયાન આ મની લૉન્ડરિંગને લગતા દસ્તાવેજો પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ઈલેક્શન કમિશન પાસેથી પણ તેને લગતા આધારપુરાવાઓ હાથ લાગ્યા હોવાથી અબજોનું મની લૉન્ડરિંગ પકડાવાની શક્યતા રહેલી છે.

## મુળ ગુજરાતની દીકરીએ અમેરિકામાં સાયકલ રેસ જીતી ડંકો વગાડ્યો

**ખેડા**

મુળ કપડવંજના વતની ૨૦ વર્ષથી અમેરિકામાં રહેતાં પાર્થિકભાઈ તેલીની પુત્રી જાન્યા અમેરિકામાં સિયેટલમાં ક્રિકસાઈડ એલિમેન્ટરી સ્કૂલમાં ધોરણ - ૨માં અભ્યાસ છે. જાન્યાએ ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરવા માટે અમેરિકામાં ધનરાશિ એકત્ર કરવા માટે સિયેટલથી પોર્ટલેન્ડના ૩૩૩ કિલોમીટરની સાયકલ રેસ માત્ર ૧૮ કલાક અને ૨૦ મિનિટમાં પૂર્ણ કરી એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પાર્થિકભાઈ તેલીની ૮ વર્ષની દીકરી જાન્યા શિક્ષણ માટે સાહસ અને સિદ્ધિ હાંસલ કરનાર કદાચ સૌથી નાની ઉંમરની બાળા છે,



# બેંગાલુરુ શહેર જળબંબાકાર : સ્કૂલ અને કોલેજો બંધ, કંપનીઓને પણ તાળા મરાયા

પાણીમાં ફસાયેલી યુવતીનું વીજ કરંટથી મોત, બીજા દિવસે પણ શહેરમાં પાણી પાણી

બેંગાલુરુ

દેશના આઈટી હબ ગણાતા બેંગાલુરુમાં અતી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન ડુબી ગયા છે તેથી બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો હતો, જ્યારે હવે મંગળવારે બેંગાલુરુની સ્કૂલોમાં રજાઓ જાહેર કરાઈ છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ ઓનલાઈન કામ કરવા કહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકો પોતાની કારોને ઘરે છોડીને ટ્રેક્ટર પર ઓફિસ જવા મજબૂર થયા છે. સતત બીજા દિવસે પણ બેંગાલુરુના મોટા ભાગના રોડ પર ઘૂંટણ જેટલા પાણી ભરાયા છે. બીજી તરફ કર્ણાટક સરકાર બેંગાલુરુની હાલત માટે જવાબદારી લેવા તૈયાર નથી અને અગાઉની સરકારો પર ઢોળી રહી છે. કર્ણાટકના



મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે બેંગાલુરુની વર્તમાન સ્થિતિ માટે અગાઉની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. જ્યારે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો હતો. બેંગાલુરુની સ્થિતિને લઈને એકબીજા પર આરોપો થઈ રહ્યા છે ત્યારે લોકોની સ્થિતિ કથળતી જાય છે.

# મેક ઈન ઈન્ડિયાને કારણે ભારતમાં શસ્ત્ર-સરંજામની અછત વર્તાવા માંડી

નવી દિલ્હી

૨૦૧૪માં સત્તાના શિબરે પહોંચ્યા બાદ દેશની આયાત નિર્ભરતા ઘટાડીને ભારતના આંતરિક અર્થતંત્રને મજબૂતી આપવાના ઉદ્દેશ્ય સાથે કરેલ મેક ઈન ઈન્ડિયા નેમ હવે દેશની સુરક્ષા માટે જ ખતરો બની રહ્યાં છે. એક અહેવાલ અનુસાર દેશમાં હવે શસ્ત્રોની અછત સર્જાઈ રહી છે અને તેના માટે જવાબદાર છે મેક ઈન ઈન્ડિયા નીતિ.

૨૦૧૪માં બાદ વડાપ્રધાન મોદીએ દેશમાં મોબાઈલ ફોનથી લઈને ફાઈટર જેટ સુધીની દરેક વસ્તુ બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા નીતિ જાહેર કરી હતી. આ યોજનાનો ધ્યેય વધુ સ્થાનિક રોજગાર સર્જન અને વિદેશી

હુડિયામણની નિકાસને અટકાવવાનો હતો પરંતુ આઠ વર્ષ પછી વિશ્વના લશ્કરી શસ્ત્રોનો સૌથી મોટા આયાતકાર દેશ ભારત હજી પણ પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા સ્થાનિક સ્તરે શસ્ત્રો બનાવવામાં અસમર્થ રહ્યું છે. સામે પક્ષે સરકારે શસ્ત્ર-સરંજામના આયાત નિયમો કડક કરતા અને અમુક શસ્ત્રો પર રોક લગાવતા હવે સુરક્ષાની સ્થિતિ વણસી રહી છે. આ મામલા સાથે સંબંધિત અધિકારીઓએ ખાનગી ધોરણે બ્લૂમબર્ગને આપેલી માહિતી અનુસાર ભારતની વાયુસેના, આર્મી અને નૌકાદળ જુના થઈ ગયેલ શસ્ત્રોને બદલે નવા શસ્ત્રો આયાત કરવામાં સક્ષમ નથી.

# એમપીમાં શિવરાજ સિંહની સરકારમાં રૂપિયા 6.94 કરોડનો રાશન-ગોટાળો 'ટેક-હોમ' રાશનમાં ભ્રષ્ટાચાર થયાનો ઘટસ્ફોટ થયો

ભોપાલ

મધ્ય પ્રદેશમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૩ વર્ષની વયનાં બાળકો, સગર્ભા તથા સ્તનપાન કરાવતી મહિલાઓ તથા ૧૧-૧૪ વર્ષનાં કિશોર-કિશોરીઓને પોષણની જરૂરીયાતો પુરી કરવા 'ટેક-હોમ' રેશન આપવામાં આવે છે. આ વિભાગ મુખ્ય-મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પાસે છે. એમાં ૬.૯૪ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ વિભાગે ૨૦૧૮ દરમિયાન આશરે ૨,૩૮૩ કરોડનું ૪.૦૫ મેટ્રિક ટન 'ટેક-હોમ' રેશન ૧.૩૫ કરોડ

લાભાર્થીઓને વહેંચ્યું હતું. પરંતુ તે અંગેના ઓડીટ-રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે રેશનનાં પરિવહન, ઉત્પાદન, વિતરણ અને ગુણવત્તામાં ઘણી ગરબડ થઈ છે. તેટલું જ નહીં પરંતુ તે રેશન માત્ર 'કાગળ ઉપર' જ વહેંચવામાં આવ્યું છે. ઓડીટર જનરલે ઓડીટ રીપોર્ટમાં જણાવ્યું છે કે, બાઈક, કાર, ઓટો રીક્ષા અને ટેકરોના નંબરો, ટ્રકના નંબર તરીકે દર્શાવી રેશન તૈયાર કરનારી કંપનીઓ પાસેથી આશરે રૂ. ૬.૯૪ કરોડનું ૧૧૨૫.૬૪ મેટ્રિક ટન રેશન પરિવહન કરાયું હોવાનું દર્શાવાયું છે.

# અનંતનાગમાં અથડામણ : વધુ 2 આતંકી ઠાર, 30-35 કિલો આઈઈડી જપ્ત કરાયું

મોટા પ્રમાણમાં હથિયારો, AK56 રાઈફલ, 35 ગોળી, બે મેગેઝીન, પિસ્તોલ મળ્યા

અનંતનાગ

અનંતનાગના બિજબિહાર વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વધુ આતંકવાદીઓની આશંકાને પગલે સુરક્ષા દળોએ શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. ઠાર કરાયેલા બં અતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસને જિલ્લાના થાજવારા વિસ્તારમાં શંકાસ્પદ લોકો હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સમગ્ર

વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક સ્થળ પર પોલીસને હિલચાલ થઈ હોવાની માહિતી મળી, ત્યારબાદ ફાટરિંગ શરૂ થઈ ગયું હતું.

પોલીસે જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ પહેલા મંગળવારે અનંતનાગ જિલ્લામાં જ સુરક્ષા દળોએ હિલચાલ મુજાહિદીનના બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલા અને નાગરિકો પર અત્યાચારના અનેક કેસમાં સામેલ

હતા, જેમાં બે ટેરિટોરિયલ આર્મીના જવાનોની હત્યાનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, અનંતનાગના પોશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી.

# ૩ દેશો ફરી રૂપિયા 1,200 કરોડનું ડ્રગ્સ ભારત પહોંચ્યું, દિલ્હી પોલીસે જપ્ત કર્યું

નવી દિલ્હી

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં દિલ્હીના કાલિન્દી કુંજ વિસ્તારમાંથી રૂ. ૧,૨૦૦ કરોડના મૂલ્યના ડ્રગ્સ સાથે અફઘાનિસ્તાનના બે નાગરિકોની ધરપકડ કરી હતી. અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ ઈરાન, બાંગ્લાદેશ થઈ ભારત પહોંચ્યું હતું તેમ દિલ્હી પોલીસે કહ્યું હતું. દરમિયાન પંજાબ પોલીસે મંગળવારે કહ્યું કે તેણે રાજ્યમાં ડ્રગ વિરોધી અભિયાન હેઠળ બે મહિનામાં ૪,૨૨૩થી વધુ



ડ્રગ દાણચોરોની ધરપકડ કરી હતી અને ૨.૭૩ કરોડના મૂલ્યનું ૧૭૫ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, તેમને એક કારમાં દિલ્હી આવતા બે અફઘાન નાગરિકો પાસે ડ્રગ્સ હોવાની ખાતમી

મળી હતી. પોલીસે કાલિન્દી કુંજ મેટ્રો સ્ટેશન નજીક આ કારને આંતરીને બંને અફઘાન નાગરિકો મુસ્તફા અને રહીમ ઉલ્લાહની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૩૧૨.૫ કિલો મેથાફેટામાઈન અને ૧૦ કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂ. ૧,૨૦૦ કરોડ છે. સ્પેશિયલ સીપી એચએસ ધાલીવાલે કહ્યું કે બંને અફઘાની નાગરિકો મૂળ કંદહારના નિવાસી છે અને ભારતમાં શરણાર્થી તરીકે રહે છે અને તેઓ તેમના વીસા બે વખત લંબાવી ચૂક્યા હતા.

# પુડુચેરીમાં ક્લાસમાં ટોપ રહેનારા વિદ્યાર્થીની ઝેર આપી હત્યા કરાઈ

છોકરા સાથે ભણતી છોકરીની માતાએ ડ્રિંકમાં ઝેર ભેળવ્યું

પુડુચેરી

પુડુચેરીમાં હરીફાઈનો એક દર્દનાક કેસ સામે આવ્યો છે. જ્યાં એક વિદ્યાર્થીનીની માકાએ બાળકીના સાથે ભણતા અન્ય એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાખ્યો હતો. મહિલાને એ વાત હેરાન કરતી હતી કે આ છોકરો હંમેશા શૈક્ષણિક અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબરે રહેતો હતો અને તેની દીકરી પાછળ રહી જતી હતી. મહિલા શુક્રવારે બાળકોની શાળાએ પહોંચી હતી અને વોચમેનને

જણાવ્યું હતું કે તે મણિકંદનની માતા છે. મહિલાએ વોચમેનને બો બોટલ સોફ્ટ ડ્રિંક આપી કહ્યું આ મારા દીકરાને આપી દેજો. કલ્ચરલ ઈવેન્ટમાં ભાગ લીધા પછી વોચમેન આ બોટલ મણિકંદનને આપી દીધી હતી. મણિકંદને એમ સમજીને આ બોટલ પી લીધી કે આ બોટલ તેની માતાએ મોકલી છે. જો કે ઘરે પહોંચતા જ તેમને વોમિટિંગ શરૂ થઈ હોસ્પિટલ લઈ ગયા હતા. શનિવારે વધુ બિમાર પડતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાતા તેનું મોત થયું હતું.

# NSE કૌભાંડમાં પૂર્વ સીઈઓ રવિ નારાયણ બે દિવસની ઈડી કસ્ટડીમાં

નવી દિલ્હી

દિલ્હી સાઉથ એવન્યૂ કોર્ટે બુધવારે એનએસઆઈના પૂર્વ સીઈઓ રવિ નારાયણને બે દિવસની ઈડી કસ્ટડીમાં સોંપ્યા હતા. મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. એનએસઈ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ અને એક્સચેન્જના કર્મચારીઓના ફોન ગેરકાયદે ટેપ કરવાના આક્ષેપસર તેમની અટકાયત કરવામાં આવી હતી. એનએસઈ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરશે. નારાયણ એપ્રિલ 1994થી 31 માર્ચ 2013 સુધી એનએસઈના એમડી અને સીઈઓ હતા. તે પછી 1 એપ્રિલ 2013થી તેમની વરણી કંપની બોર્ડમાં ઉપાધ્યક્ષપદે થઈ હતી.

# સમગ્ર દેશમાં પશુપાલકો ચિંતિત: લમ્પી વાયરસ 50,000થી વધુ પશુઓના મોત

લમ્પી વાયરસ દેશના 24 જેટલા રાજ્યોમાં ફેલાતા ફફડાટ

નવી દિલ્હી

દેશના પશુપાલકો અત્યારે લમ્પી સ્કિન રોગથી ખરાબ રીતે પ્રભાવિત છે. સરકારી આંકડા અનુસાર 31 ઓગસ્ટ સુધી 49,628 ગૌવંશના મોત થઈ ચૂક્યા છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ અનુસાર 12 રાજ્યોના 165 જિલ્લા આનાથી પ્રભાવિત છે અને બે કરોડથી વધારે પશુ આ બીમારીની ચપેટમાં આવવાની આશંકામાં છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓ અનુસાર બીમારી 24

રાજ્યોમાં ફેલાઈ ચૂકી છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ સુધી આના સંક્રમણથી ગાયોના મોત થઈ રહ્યા છે પરંતુ આ ભારે સંકટ છતાં રાજ્ય સરકાર આને મહામારી જાહેર કરી રહી નથી. અત્યાર સુધી આ બીમારીની કોઈ સારવાર નથી. જોકે વેક્સિન છે અને અત્યારે ગોટ એન્ડ શીપ પોક્સ વેક્સિન પશુઓને આપવામાં આવી રહી છે. આ વેક્સિન બીમારીથી બચાવ તો કરે છે પરંતુ સમગ્રીને બચાવ કરતી નથી.

# પીએમ મોદીના નામે કોઈ કોઈ પણ જીતી શકે છે, સંગઠન જરૂરી : અમિત શાહ

નવી દિલ્હી

ભાજપની મંથન બેઠક દરમિયાન પાર્ટી પ્રમુખ જેપી નડા અને અમિત શાહે આકર્ષક વલણ અપનાવ્યું હતું. જે પણ મંત્રીઓએ પોતાને ફાળવવામાં આવેલા સંસદીય ક્ષેત્રોની મુલાકાત લઈને ત્યાં શું સ્થિતિ છે તેનો તકાજો નથી મેળવ્યો તેમને અમિત શાહે ચેતવણી આપી દીધી હતી. અમિત શાહે મંત્રીઓને કહ્યું હતું કે, 'આપણે અહીં સંગઠનના કારણે છીએ. સરકાર પણ સંગઠનના કારણે છે. સંગઠનને પ્રાથમિકતા આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય છે. પીએમ મોદીના નામે કોઈ પણ જીતી શકે છે પરંતુ જો જમીની સ્તરે કોઈ સંગઠન નથી તો આપણે તેનો ફાયદો નહીં ઉઠાવી શકીએ.'



# ઓન્ટેરિયોમાં હોસ્પિટલના દર્દીઓને લાંબા ગાળાના વૈકલ્પિક કેર હોમ્સમાં ખસેડવા ખરડો

# ટીવી- ડિજિટલ મીડિયા ક્ષમતા સાથે ધમધમતા થવાની આશા

લાંબા ગાળાની સારવાર માટે ઈન્કાર કરનાર દર્દીને બિલના નાણા મળશે નહીં

**ઓહાવા**

ઓન્ટેરિયોની પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ સરકારે બુધવારે કાયદો પસાર કર્યો હતો કે, જે હોસ્પિટલના દર્દીઓ નર્સિંગ હોમમાં લાંબા ગાળાની સારસંભાળની રાહ જોતા હતા તેઓની સમસ્યા કંઈક હળવી થવાની આશા છે.

આ અંગે એક ખરડો તૈયાર કરાયો છે. જો કે, નવા કાયદાની ઘણી વિગતો હજુ જાણવા મળી નથી. સામાન્ય રીતે જે દર્દીઓ લાંબા ગાળાની સારસંભાળ માટે જવાનો ઈનકાર કરે છે તેમની

પાસેથી ફી વસૂલવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, જો કે આ ફી કેટલી વસૂલવી એ હજુ અસ્પષ્ટ છે. પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું છે કે, તેઓને પ્રતિ દિવસ 1,800 ડોલરના વીમા વિનાના દરનું બિલ આપવામાં આવશે નહીં. આ કાયદાનો હેતુ દર્દીઓને યોગ્ય સારસંભાળ પૂરી પાડવાનો છે.

તેમણે વિધાનસભામાં કહ્યું કે આ કોઈ ખર્ચ વિશે નથી. આ તો લોકોને લાંબા ગાળાની યોગ્ય આરોગ્ય સેવા આપવા વિશે છે જે જરૂરી છે.

બિલ પસાર થયા પછી લોંગ ટર્મ કેર મંત્રી પૌલ કેલેન્ડ્રા અને આરોગ્ય મંત્રી સિલ્વિયા જોન્સે પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું. NDP લીડર પીટર ટેબન્સે જણાવ્યું હતું કે, નવો કાયદો વરિષ્ઠોને નુકસાન પહોંચાડશે અને બિનજરૂરી દુઃખનું કારણ બનશે. તેમણે એમ પણ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે આ કાયદાથી અમુક લોકોની ગુંડાગીરી વધશે. તેઓને મોટા બિલો મળશે અને ઘણાંને દરવાજાની બહાર પણ ધકેલી દેવામાં આવશે.

**ઓન્ટેરિયો**

ટોરોન્ટોના ફિલ્મ, ટીવી ઉદ્યોગ શહેરના પાવર ગ્રીડ દ્વારા ગ્રીન એનર્જીમાં ઉપયોગી થઈ શકે છે. સિટીએ સોમવારે જાહેરાત કરી હતી કે, તે પ્રોડક્શન કૂને ટોરોન્ટોના પાવર ગ્રીડમાં બે અત્યંત ઉપયોગમાં લેવાતા ફિલ્મ સ્થળો- એશબ્રિજ બે પાર્ક અને સર કાસિમિર ગઝોવસ્કી પાર્ક ઉપર એક્સેસ આપશે.

સિટીએ જણાવ્યું હતું કે, આ યોજનાથી પ્રોડક્શન કંપનીઓ તેની ઈલેક્ટ્રિસિટી ગ્રીડનો ઉપયોગ અશ્મિભૂત ઈંધણને બાળવાને બદલે કૂ ટ્રેઈલર્સ અને ઓફિસ જેવી વસ્તુઓને માટે કરશે.

મેયર જહોન ટોરીએ જણાવ્યું હતું કે, આ પગલું શહેરના કાર્બન ફૂટપ્રિન્ટને દર

વર્ષે 400 ટન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે, જે 45 ઘરો દ્વારા વપરાતી વાર્ષિક ઊર્જાની સમકક્ષ છે. આ પાવર ડ્રોપ થાય છે, લોકો તેમને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક સામાન્ય ભાગ તરીકે જોઈ છે, જે તેઓ આખા શહેરમાં જોવા માટે ટેવાયેલા છે. શહેરનો ફિલ્મ, ટીવી અને ડિજિટલ મીડિયા પ્રોડક્શન ઉદ્યોગ આ વર્ષે વધવાની અપેક્ષા છે. વસંત સુધીમાં સ્થાનિક સ્ટુડિયો ફરીથી પૂરી ક્ષમતા સાથે કામ કરતા થઈ જશે. 2021માં આ ઉદ્યોગે ટોરોન્ટોમાં 2.5 બિલિયન ડોલરનો રેકોર્ડ ખર્ચ કર્યો હતો. ટોરીએ જણાવ્યું હતું કે, આ ઉદ્યોગથી શહેરને આ દિશામાં કામ કરવા માટે પ્રેરણા મળશે કે સ્થાનિક ઉત્પાદન ગ્રીન થઈ શકે.

# પ્લાઝમા સપ્લાય વધારવા કેનેડિયન પ્લઝ સર્વિસના કંપની સાથે સંધિ કરાર

# કેનેડાના નવા એક્સપ્રેસ એન્ટ્રી 'ડ્રો'માં ITAs વધારવાનું હજુ પણ ચાલુ રાખશે

ઓછી રોગપ્રતિકારક શક્તિ, કિડની અને યકૃતના રોગો તથા કેન્સરના દર્દીઓને રાહત થશે

**ઓન્ટેરિયો**

પ્લઝ કલેક્શન કરતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાએ એક સમાચાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે, અજ્ઞાત સંખ્યામાં દરખાસ્તોની સમીક્ષા કર્યા પછી CBSએ સ્પેનમાં મુખ્ય મથક ધરાવતી કંપની ટ્રિફોલ્સ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જે પ્લાઝમા દવાઓનાં ઉત્પાદનમાં નિષ્ણાત છે.

સીબીએસના સીઈઓ ડો. ગ્રેહામ શેરે બુધવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ સમજૂતીએ ખૂબ જ મહત્વપૂર્ણ રીતે રક્ષણ

અને સલામતિનું નિર્માણ કર્યું છે, જે રાષ્ટ્રીય રક્ત પ્રણાલીને ખાતરી કરવા માટે જરૂરી છે. સીબીએસ કહે છે કે તે પ્લાઝમા માટે રાષ્ટ્રીય પુરવઠાની માંગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે, જે રક્તમાં પ્રોટીન-સમૃદ્ધ પ્રવાહી કે જે રક્ત ઘટકોને સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. CBS અનુસાર તેનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિની ખામીઓ અને દુર્લભ રક્ત વિકૃતિઓ, કિડની અને યકૃતના રોગો, વિવિધ કેન્સરના દર્દીઓ અને અન્ય લોકોને મદદરૂપ થવા કરાશે. કેટલાક હિમાયતીઓ કહે છે કે વ્યાપારી ભાગીદારોને બોલાવતા પહેલા સીબીએસએ કેનેડામાં સ્વૈચ્છિક દાન વધારવા માટે પૂરતું કામ કર્યું નથી.

જુલાઈથી શરૂ થયેલા દરેક ડ્રો સાથે ઉમેદવારોની સંખ્યામાં 250નો વધારો

**ટોરોન્ટો**

ઈમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ તેનો પાંચમો ઓલ-પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો 6 જુલાઈથી શરૂ કર્યો હતો. IRCCએ 18 મહિનાથી વધુ સમય માટે ડિસેમ્બર 2020થી શરૂ થતાં તમામ પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોને અટકાવી દીધા હતા. આ સમય દરમિયાનમાત્ર CEC અથવા પ્રાંતીય નોમિની પ્રોગ્રામ (PNP) હેઠળ કાયમી નિવાસ

માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને જ અરજી કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જો કે, સપ્ટેમ્બર 2021માં CEC ડ્રોને પણ અટકાવવામાં આવ્યો હતો. COVID-19 રોગચાળો વધુ ન ફેલાય એ માટે મોટી સંખ્યામાં કાયમી રહેઠાણની અરજીઓ સબમિટ કરવાનું અટકાવવા આ પગલું લેવાયું હતું.

આ સમય દરમિયાન કેનેડાની સરહદ બંધ થઈ ગઈ અને મુસાફરીના નિયમો વારંવાર બદલાયા હતા. આ ડ્રો ITAમાં સૌથી વધુ 500નો વધારો દર્શાવે છે, કારણ કે તમામ ડ્રો 6 જુલાઈથી ફરી શરૂ થયા છે. આજના ડ્રો સુધી, ITA મેળવનારા ઉમેદવારોની સંખ્યામાં દરેક ડ્રો સાથે 250 જેટલો વધારો થઈ રહ્યો છે.

# સ્કારબોરોના રાધાકૃષ્ણ મંદિરે આસ્થા કલ્ચરલ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ ઉજવાયો

# વાનકુવરમાં ભાડાના 3,000 ઘરો માટે 1.4 બિલિયન ડોલરનો ખર્ચ કરાશે

ફેડરલ સરકાર ચારમાંથી પ્રથમ બે તબક્કાઓ માટે નાણાં આપશે



**ઓન્ટેરિયો**

સ્કારબોરો સ્થિત કેનેડાની જાણીતી સંસ્થા આસ્થા કલ્ચરલ ગ્રુપ દ્વારા રાધાકૃષ્ણ મંદિર, સ્કારબોરો ખાતે પાંચ દિવસ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગરબા, ભજન, અન્નકૂટ તથા અવનવા મનોરંજક કાર્યક્રમો સૌએ ભાવભક્તિથી માણ્યા હતા. નવા ઈમીગ્રન્ટ્સ માટે રાધાકૃષ્ણ મંદિર અને આસ્થા કલ્ચરલ ગ્રુપ આશીર્વાદ સમાન છે અને તેમની ટીમમાં વિજય પટેલ, યોગેશ ઠાકર, કૃષ્ણકાંત પરિખ અને રાજેશ બ્રહ્મભટ્ટ ખુબ જ જહેમત ઉઠાવે છે. પૂજાની સ્પોન્સરશિપ મિર્યમસાલા

તેમજ અન્નકૂટ માટે પંચવીટ ગ્રોસરી સ્ટોર્સનો સહકાર મળ્યો હતો. આસ્થા ગ્રુપ દ્વારા રોજે રોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા મહેમાનો ચંદ્રકાંત ઠાકર, અશ્વિન અમીન, પૂર્વિન પટેલ, લલિત ઠાકર, પ્રણવ પટેલ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આસ્થા ગ્રુપ દ્વારા તમામ સભ્યો, સપોર્ટર્સ, મહેમાનો મંદિરના શર્માજી વિગેરેનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. હરકાંત પટેલના ગરબામાં લોકો મન મુકીને રમ્યા હતા. વિસર્જનમાં પૂર્વિન પટેલ દ્વારા ઢોલ બેન્ડે જમાવટ કરી દીધી હતી.

ફેડરલ સરકાર વાનકુવર-એરિયા ફર્સ્ટ નેશનને 3,000 ઘરો બાંધવા માટે 1.4 બિલિયન ડોલરની લોન આપશે, જે એક વખત એક પ્રાચીન ગામ હતું જે એક સદી પહેલા બાળી નાખવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહમાં સ્કવામિશ નેશને જણાવ્યું

હતું કે, કેનેડાના ઇતિહાસમાં આ વિકાસ સૌથી મોટો સ્વદેશી આગેવાની હેઠળનો આવાસ અને રિટેલનો વિકાસ છે. સ્કવામિશ નેશન કાઉન્સિલના ચેરપર્સન બેલસિલેમે જણાવ્યું હતું કે, અમે અમારા ભાગીદારો સાથે જે પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ, તે અમારી જમીનોના ઉપયોગ દ્વારા થનારો મોટો આર્થિક વિકાસ બની રહેશે.

જે સ્કવામિશ લોકોને 10 બિલિયન ડોલરથી વધુ વળતર આપશે. તેમણે ઉમેર્યું હતું કે, ભાડાના એકમોના વિકાસના વધારાના પુરવઠામાં વાનકુવરમાં રહેઠાણની કિંમત અને ઉપલબ્ધતા બંનેમાં ફેરફાર થવાની સંભાવના છે. ખાસ કરીને વાનકુવરમાં, જગ્યા શોધવી અઘરી છે. રેન્ટલ માર્કેટ વેકેન્સી રેટ ખૂબ જ ઓછો છે.

# લાયનહેડ સિનિયર સમાજ બ્રામ્પટનની પિકનિક : રમતો બાદ ગરબા ગવાયા

**બ્રામ્પટન**

બ્રામ્પટનથી પશ્ચિમ છેવાડે મીસીસાગા રોડ ઉપર લાયનહેડ ગોલ્ફ ક્લબ રોડ ખાતેના નવા વિકસિત વિસ્તારમાં ગુજરાતીઓની વસ્તી વધતા સિનિયરોની સંખ્યામાં પણ વધારો થયો છે. સિનિયરોના આનંદ માટે લાયનહેડ સિનિયર સમાજના પ્રમુખ જગદીશભાઈ ઉપાધ્યાય અને સભ્ય રજનીભાઈ જગદીશભાઈ ઉપાધ્યાય અને સભ્ય રજનીભાઈ પટેલ દ્વારા પિકનિકનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. સિનિયરોના આનંદ માટે સૌ પ્રથમ વખત ઓલ્ડોરાડો પાર્ક ખાતે સાંજે પ



થી ૮ દરમિયાન પિકનિકનું આયોજન કરાયું હતું. આ તકે એકત્ર થયેલા સભ્યો દ્વારા ઉભી ખો, અંતાક્ષરી વિગેરે રમતો રમીને આનંદ મનાવાયો હતો. જે બાદ સભ્યો ગરબા ગાઈને ઝૂમી ઉઠ્યા

હતા. ત્યારબાદ પંજાબી ભોજન અને ત્યારબાદ તરબૂચનો આસ્વાદ લઈને સૌ છટા પડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચીનુભાઈ પટેલ, અશ્વિનભાઈ શાવલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

ગરબા, ભજન, અન્નકૂટ તથા અવનવા મનોરંજક કાર્યક્રમો યોજાયા, શ્રીજીને ભક્તિભાવ સાથે વિદાય પણ અપાઈ



# એશિયા કપ: રવિવારે પાકિસ્તાન - શ્રીલંકા વચ્ચે ફાઈનલ

દુબઈ ખાતે ચાલી રહેલી એશિયા કપ-૨૦૨૨ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુપર-૪ રાઉન્ડમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાન અને ભારતને પરાજય આપી ફાઈનલમાં પહોંચ્યું હતું. જ્યારે પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાનને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે રવિવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.

**શ્રીલંકા આખરી ઓવરના તનાવ બાદ છ વિકેટથી જીત્યું**

દુબઈ: કુંગાળ બેટિંગ બાદ બોલરો અને ફિલ્ડરોના સરેરાશ દેખાવ બાદ ભારતનો શ્રીલંકા સામેની એશિયા કપ સુપર-ફોરની મેચમાં પરાજય થતાં ભારતીય ચાલકોમાં નિરાશા ફેલાઈ હતી. ભારતને આખરી ઓવરના પાંચમા બોલ પર બે વાર રનઆઉટની તક મળી હતી, પણ પંત-અર્ષદીપ તે તકને ઝડપી શક્યા નહતા અને આખરે ભારત હાર્યું હતું. જીતવા માટેના ૧૭૪ના ટાર્ગેટને શ્રીલંકાએ ૧૮.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. કુસલ મેન્ડિસ (૫૭) અને નિસાંકા (૫૨)એ અડધી સદી ફટકારી હતી. રોહિતના ૪૧ બોલમાં ૭૨ રન ભારતને જીતારી શક્યા નહતા. શનાકા ૧૮ બોલમાં ૩૩ અને રાજપક્સા ૧૭ બોલમાં ૨૫ રને નોટઆઉટ રહ્યા હતા.



**પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સામે એક વિકેટથી વિજય**

શારજાહ: ૧૦માં કમના બેટ્સમેન નસીમ શાહે આખરી ઓવરમાં ફારૂકીની બોલિંગમાં પહેલા જ બે બોલ પર બે સિક્સર ફટકારતાં પાકિસ્તાને હાર્દવોલ્ટેજ મુકાબલામાં અફઘાનિસ્તાન સામે એશિયા કપ સુપર-ફોર ટી-૨૦માં ૧ વિકેટથી દિલ્લખડક વિજય મેળવ્યો હતો. જીતવા માટે પાકિસ્તાનને આખરી ઓવરમાં ૧૧ રનની જરૂર હતી અને તેમની ૧ જ વિકેટ સલામત હતી, ત્યારે નસીમે બે સિક્સર ફટકારીને સનસનાટી મચાવી હતી. અફઘાનિસ્તાન હારતાં ભારત એશિયા કપમાંથી બહાર ફેંકાયું હતું. જ્યારે રવિવારે તારીખ ૧૧ સપ્ટેમ્બરે હવે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ રમાશે.

## બાબર આઝમને પાછળ રાખીને રિઝવાન નંબર-૧ બેટ્સમેન બન્યો

દુબઈ: આઈસીસી ટી૨૦ બેટ્સમેનોની રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ટી૨૦માં લાંબા સમયથી પ્રથમ સ્થાને રહેલા પાકિસ્તાનના સુકાની બાબર આઝમની એક ક્રમાંકની પીછેહઠ થઈ છે. ભારતીય સુકાની રોહિત શર્માને પણ ફાયદો થયો છે. એશિયા કપમાં બાબર કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નથી અને તેને ૧૬ પોઈન્ટનું નુકસાન થયું છે અને તે બીજા ક્રમે સરકી ગયો છે. તેના સાથી ઓપનર મોહમ્મદ રિઝવાનને ૧૮ રેટિંગ પોઈન્ટનો ફાયદો થયો છે અને તે ૮૧૫ પોઈન્ટ સાથે પ્રથમ



સ્થાને પહોંચી ગયો છે. રિઝવાન પ્રથમ ક્રમાંકિત બેટ્સમેન બનનાર પાકિસ્તાનનો ત્રીજો ખેલાડી છે. આ પહેલાં મિસબાહ ઉલ હક અને બાબર નંબર-૧ બન્યા હતા. ભારતનો સૂર્યકુમાર યાદવ એક ક્રમાંક પાછળ સરકીને ચોથા, રોહિત ચાર ક્રમાંકના ફાયદા સાથે ૧૩ તથા વિરાટ કોહલી ૨૮મા ક્રમાંકે પહોંચ્યા છે.

**ભારતની અનુપમા ઉપાધ્યાય વર્લ્ડ જુનિયર બેડમિંટન રેન્કિંગમાં નંબર વન નવી દિલ્હી**

ભારતની અનુપમા ઉપાધ્યાય વર્લ્ડ જુનિયર બેડમિંટન રેન્કિંગમાં નંબર વન પર પહોંચી હતી. જ્યારે અગાઉ ટોચનું સ્થાન મેળવી ચૂકેલી ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી તસ્નીમ મીર હાલ અંડર-૧૮ ગર્લ્સ સિંગલ્સમાં અનુપમા પછી બીજા સ્થાન પર છે. વિશ્વની ટોચની ૧૦ ખેલાડીઓમાં ભારતની ચાર ખેલાડીનો સમાવેશ થાય છે. પાંચકુલાની બેડમિંટન ખેલાડી અનુપમાએ યુગાન્ડા અને પોલેન્ડમાં જુનિયર ટાઈટલ્સ જીત્યા હતા અને તેણે ટોચનું સ્થાન મેળવ્યું હતું.

## હરમનપ્રીત સિંઘ આંતરરાષ્ટ્રીય હોકી પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેશન

**ભારતના શ્રીજેશ-સવિતા ગોલકિપરના એવોર્ડની રેસમાં**

ભારતના ડ્રગ ફિલ્ડર હરમનપ્રીત સિંઘને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના બેસ્ટ પ્લેયર ઓફ ધ યરના એવોર્ડ માટે નોમિનેશન આપવામાં આવ્યું છે. જ્યારે બેસ્ટ ગોલકિપર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં ભારતના પી.આર. શ્રીજેશ અને સવિતા પુનિયાને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે ૩૦ સપ્ટેમ્બર સુધી વોટિંગ ચાલશે. જ્યારે વિજેતાની જાહેરાત ઓક્ટોબરના પ્રારંભમાં કરવામાં આવશે. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન

હરમનપ્રીતની સાથે બેલ્જિયમના આર્થર ડી સ્કૂવર અને ટોમ બૂનને તેમજ જર્મનીના નિકલસ વેલેન અને નેધરલેન્ડના થિયરી બ્રિન્કમાનને પણ નોમિનેશન આપવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓએ ગત વર્ષના વાર્ષિક એવોર્ડમાં સપાટો બોલાવ્યો હતો. હરમનપ્રીતે બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે મેન્સ ટીમના કોચ ગ્રેહામ રિડની સાથે ગોલકિપર સવિતા અને શ્રીજેશ પણ એવોર્ડ જીત્યા હતા.

|| અક્ષરમ અહં પુરુષોત્તમ દાસોસ્મિ ||

# મહાપુરુષોના અનુભવોથી જીવનમાં ઉજાસ પથરાય

મહાભારતનાં વનપર્વમાં યજ્ઞ અને યુધિષ્ઠિર વચ્ચે પ્રશ્નોત્તરી છે, જેમાં જીવનના ગૂઢ રહસ્યો વિષે પૂછાયેલ પ્રશ્નોના ધર્મરાજ યુધિષ્ઠિરે અદભૂત ઉત્તરો આપ્યા છે. તે સાંપ્રત વિશ્વમાં પણ ખૂબ સુસંગત અને ઉપયોગી છે. તેમાંનો એક પ્રશ્ન છે- ક: પંથા: ? 'માર્ગ કયો છે?' જેના પ્રત્યુત્તરમાં યુધિષ્ઠિર જણાવે છે કે 'મહાજનો યેન ગત: સ પંથા:' મહાન પુરુષો જે માર્ગે ચાલ્યા છે તે જ અનુકરણીય માર્ગ છે.

સામાન્ય રીતે માણસ અનુભવોમાંથી શીખતો હોય છે. પણ જીવન ટૂંકું છે. આપણી પાસે એટલો સમય નથી કે, આપણે બધા અનુભવો કરી શકીએ. એટલે જ શાણા માણસો જીવનના ડગલાં એ રાહ પર માંડે છે જે રાહ ઉપર મહાન વ્યક્તિઓ ચાલ્યા છે.

મહાપુરુષોના અનુભવ ઉજાસથી પોતાના જીવન પંથને અજવાળે છે. કળિકાળમાં અલ્પ આયુષ્ય ધરાવતા માનવ માટે ગુણવત્તાસભર, સફળ અને સાર્થક જીવન જીવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

આજે વિશ્વ માહિતીથી ઉભરાઈ રહ્યું છે. જ્ઞાનનાં આ અનંત ખજાનામાં આપણા માટે શું ઉપયોગી છે તે શોધવું ઘાંસની ગંજીમાં સોંચ શોધવા જેવું દુષ્કર બની રહે છે. પણ તે સમયે તે ક્ષેત્રનાં કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન આપણા સમય, શક્તિ અને સંસાધનોની બચત કરે છે. આપણે લીધેલા નિર્ણયો વધુ નક્કર અને સાચી દિશામાં પડે છે.

આક્રિટિકરની દુનિયાની એક નામાંકિત શૈક્ષણિક સંસ્થા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન (NID)ના પ્રોફેસર દશરથ પટેલ પોતાની કારકિર્દીના વીસમાં વર્ષે નવા વિદ્યાર્થીઓને વાત કરતાં કહેતા: "આ ક્ષેત્રમાં આ

મારું ૨૦મું વર્ષ છે. હું જે કહું એ કરવાનું તમે પસંદ કરશો તો આ ક્ષેત્રમાં આ તમારું ૨૧મું વર્ષ બની રહેશે, અને જો તમે તમારી ઈચ્છા મુજબ કામ કરવાનું પસંદ કરશો તો આ તમારો પ્રથમ દિવસ છે." અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન કેટલો મોટો તફાવત ઊભો કરી શકે તે સમજાવવા માટે

**પ્રમુખ સ્વામી મહારાજે 51થી વધુ દેશોમાં 17000થી વધુ ગામડાઓમાં અને અઢી લાખથી વધુ ઘરોમાં વિચરણ કરીને તેઓએ અનેકને સદ્-માર્ગે વાળ્યા છે**

આ એક વાક્ય પૂરતું છે. મહાન વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટને રોબર્ટ હૂકને એક પત્રમાં લખ્યું હતું, "હું વધુ દૂર સુધી જોઈ શક્યો છું, કારણ કે હું વિરાટ પ્રતિભાઓના ખભા ઉપર ઉભો છું"

આમ ક્ષેત્ર કોઈ પણ હોય, વિજ્ઞાનનું કે આર્કિટેક્ચરનું, પણ જો ઝડપ પકડવી હોય અને દૂર સુધી જવું હોય તો રસ્તો આ જ છે કે, મહાનપુરુષોના અનુભવ અમૃતમાંથી પ્રેરણા મેળવી આગળ વધતાં રહીએ.

જેમની પાસે અનુભવ છે, શુદ્ધ આચરણ છે અને જેઓના આશય પરિશુદ્ધ છે તેવા મહાનુભવોએ આપેલો સંદેશ સમગ્ર જીવતરને સાર્થક બનાવે છે.

૨૦૨૨નું આ

વર્ષ વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનું જન્મ શતાબ્દી વર્ષ છે. તેઓના બહોળો અનુભવ, નિષ્કલંક જીવન, અને પવિત્ર અંત:કરણમાંથી આવેલા અમૃતવચનોથી લાખો લોકોને પ્રેરણા મળી છે. ૮૫ વર્ષના પોતાના જીવનમાં ૫૧થી વધુ દેશોમાં, ૧૭,૦૦૦થી વધુ


ગામડાઓમાં અને અઢી લાખથી વધુ ઘરોમાં વિચરણ કરીને તેઓએ અનેકને સદ્-માર્ગે વાળ્યા છે. ૪૦ લાખથી વધુ લોકોને તેઓ વ્યક્તિગત રીતે મળ્યા છે અને સાડા સાત લાખથી વધુ પત્રોના જવાબ આપી લોકોના સુખ-દુ:ખમાં તેઓ સહભાગી થયા છે.

દેશ-વિદેશમાં ૧૧૦૦થી વધુ મંદિરો, ગાંધીનગર અને દિલ્હી જેવા ભવ્ય અક્ષરધામ સ્મારકો, ૧૧૦૦થી વધુ સુશિક્ષિત સંતો, આંતરરાષ્ટ્રીય સમૈયા-ઉત્સવો તેઓના વિશ્વસ્તરીય અનુભવોની સાહેદી પૂરે છે. તેઓનું અણીશુદ્ધ આચરણ તેમના સંપર્કમાં આવેલા પ્રત્યેક હૈયાને સ્પર્શ્યું છે.

અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લીન્ટને કહ્યું હતું, "હું જ્યારે પ્રમુખસ્વામીની આંખોમાં જોવું છું ત્યારે મને તે શુદ્ધ ભાવનાથી છલકાતી દેખાય છે. તેઓ બીજાને આગળ કરીને આગળ આવ્યા છે, બીજાને ઝાંખા પાડીને નહીં." એક વખત પ્રમુખસ્વામી મહારાજે સહજતાથી કહ્યું હતું, "કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી." જ્યાં આશયોમાં શુદ્ધિ છે, ત્યાં વિચારોમાં મલિનતા પ્રવેશી શકતી નથી. અને જ્યાં વિચારો પવિત્ર છે ત્યાં આચરણ નિષ્કલંક હોય છે. આવા અનુભવી, સદાચારથી સંપન્ન પ્રમુખસ્વામી મહારાજની પ્રેમ સરવાણીથી અનેકના જીવન ઉન્નત થયા છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યું છે, તો કોઈ સ્વભાવોની જેલમાંથી મુક્ત થયું છે, કેટલાંય ભાંગેલા હૈયામાં નવું જોમ ભરાયું છે, તો કેટલાંયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે.

વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓનાં સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે. તેથી આ વર્ષે આ લેખમાળા - 'પ્રમુખ સંદેશ'માં તેઓના અનુભવ અમૃતમાંથી પ્રેરણા લઈને આપણે પણ આપણા જીવનને વધુ મૂલ્યસભર બનાવીશું. અંતમાં અમેરિકન કવિ અને કેળવણીકાર હેન્ન્રી લોંગફેલોનું એક વાક્ય યાદ રહે, "A single conversation across the table with a wise man is better than ten years mere study of books." - "સમજદાર માણસ સાથેનો એક વાર્તાલાપ દશ વર્ષ સુધી કરેલા પુસ્તકોના અભ્યાસ કરતા ચડિયાતો સાબિત થાય છે."

'પ્રમુખ સંદેશ' પણ આપણા જીવનને વેગપૂર્વક સફળતા અને સાર્થકતા ભણી દોરી જશે.





# ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાપ્રધાન બન્યાં

રિશિ સુનકને 60,399 અને લિઝ ટ્રસને 81,326 મતો મળ્યાં 82 ટકા મતદાન થયું

લંડન

ભારતીય મૂળના રિશિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાપ્રધાન બન્યાં છે. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા. રિશિ સુનકને કન્ઝર્વેટિવના ૬૦,૩૯૯ સભ્યોએ મત આપ્યાં હતાં. બંને વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે બરાબરીનો મુકાબલો થયો હતો. કુલ ૧,૭૨,૪૩૭ કન્ઝર્વેટિવ સભ્યોએ મતદાન કર્યું હતું. માર્ગરિટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવા માટે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. બોરિસ જોન્સનનું સ્થાન લેવા માટે થયેલા આ મતદાનમાં રિશિ સુનકનો પરાજય થયો હતો અને લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં હતાં.



માર્ગરિટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. લિઝ ટ્રસની ઈમેજ બ્રિટનના રાજકારણમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. બે મહિલા લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શરૂઆતી રાઉન્ડમાં રિશિ સુનક બધા ઉમેદવારોથી આગળ રહ્યા હતા.

# ઝિમ્બાબ્વેમાં ચાર જ મહિનામાં ઓરીથી ૭૦૦ બાળકોનાં મોત

રસીકરણને ફરજિયાત બનાવવા કાયદો ઘડવા માગ હરારે



ઝિમ્બાબ્વેમાં ઓરીના પ્રકોપથી મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા વધીને ૭૦૦ થઈ ગઈ છે તેમ દેશના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ દરમિયાન દેશમાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે કાયદો બનાવવાની માગ ઉઠી રહી છે.

૧.૫ કરોડની વસ્તીવાળા આ દેશમાં ધાર્મિક સંપ્રદાયોના પ્રભાવને કારણે રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. દેશના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલમાં શરૂ થયેલા ઓરીના પ્રકોપથી અત્યાર સુધીમાં ૬૮૮ બાળકોનાં મોત થયા છે.

મંત્રાલયે જણાવ્યું છે કે આ મોત પૈકી ૩૭ મોત તો ફક્ત એક જ દિવસ પહેલી સપ્ટેમ્બરે થયા છે. ચાર સપ્ટેમ્બર સુધીમાં દેશમાં ઓરીના ૬૨૯૧ કેસ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે સપ્તાહ અગાઉ ઝિમ્બાબ્વેના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઓરીના કારણે ૧૫૭ બાળકોનાં મોત થયા છે.

# ડોનાલ્ડ ટ્રમ્પની 2024માં પ્રેસિડેન્ટ પદની ચંટણી લડવા માટે વિચારણા

ન્યૂયોર્ક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પ્રેસિડેન્ટ પદની ચંટણી લડવા માટે વિચારણા કરી રહ્યા છે. જોકે બીજી બાજુ તેમના પર ખૂબ જ ગંભીર આરોપો પણ છે. એફબીઆઈદ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવા દસ્તાવેજો બહાર કાઢ્યા છે. ટ્રમ્પે જણાવ્યું કે, છે કે, ૨૦૨૪માં તેઓ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે, તેઓ ચૂંટણી લડે. ટ્રમ્પ દ્વારા કરવામાં

આવેલા દાવા પ્રમાણે અત્યાર સુધીમાં લોકપ્રિયતા માટે જેટલા પણ સર્વે થયા (રિપબ્લિકન પાર્ટી કે પછી વિપક્ષી) તેમાં પોતે સૌથી આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'હું આ સર્વેમાં અને દરેક સર્વેમાં આગળ ચાલી રહ્યો છું, મને લાગે છે કે હું નજીકના ભવિષ્યમાં જલ્દી જ નિર્ણય લઈશ. અને મને લાગે છે કે મારા નિર્ણયના કારણે અનેક લોકોને આનંદ થશે.' ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ભારતીય-અમેરિકી વેપારી શલભ કુમાર તેમના સાથે છે એ ૨૦૨૪માં તેઓ ચૂંટણી લડશે તેનો સંકેત છે?

# બુર્કિના ફાસોમાં આતંકવાદીઓનો હુમલો ૩૫ લોકોનાં મોત, અનેક લોકો ઘાયલ

સામાન્ય નાગરિકો સહિત સેનાની સુરક્ષા સાથે જતાં વાહનોના કાફલા પર વિસ્ફોટ

ઓગાડોગુ

ઉત્તરી બુર્કિનામાં શંકાસ્પદ જેહાદી બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૫ લોકોનાં મોત થયા છે અને અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. સાહેલ ક્ષેત્રના ગવર્નર લેફ્ટનન્ટ કર્નલ રોડોલ્ફ સોરઘોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બુર્જોગા અને દજિબો શહેરોની વચ્ચે સેનાની સુરક્ષામાં સામાન લઈ જઈ રહેલા વાહનોનો એક કાફલામાં બોંબ વિસ્ફોટ થયો હતો. આ કાફલાના એક વાહનમાં સામાન્ય નાગરિકો હતાં. ગવર્નરે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અન સુરક્ષા દળોએ વિસ્ફોટ સ્થળની નાકાબંધી કરી લીધી છે. હાલમાં કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે ઈસ્લામિક ઉગ્રવાદીઓ



દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુર્કિના ફાસો અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના નિશાન પર રહ્યું છે અને તેમના દ્વારા કરાયેલા હુમલામાં હજારો નાગરિકોનાં મોત થયા છે.

# ચીનના સિયુઆનમાં ભૂકંપના આંચકા સાથે અફરાતફરીનો માહોલ: 65 નાગરિકના મોત

શાંઘાઈ

ચીનના સિયુઆનમાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે અને 16 લોકો લાપતા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડોમાં બધું બરબાદ થઈ ગયું. અહીંની ઘણી ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર લુઈંગ કાઉન્ટી હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. ખડકો પણ સ્થળોએ તૂટી પડ્યા હતા અને રસ્તાઓ પર પડ્યા હતા, જ્યારે લોકો રહેણાંક વિસ્તારોમાં ઈમારતોના કાટમાળ નીચે દટાયા હતા ગાંજ અને યાઆનમાં ફસાયેલા 50,000 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સિયુઆનમાં 6,500 થી વધુ બચાવ ટીમો, ચાર હેલિકોપ્ટર અને બે માનવરહિત હવાઈ



વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ફાયર બ્રિગેડની 1100 ટીમો તૈનાત કરવામાં આવી છે. નાણા મંત્રાલય અને ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે લગભગ 7.25 મિલિયન યુએસ ડોલર નાણાકીય સહાય પૂરી પાડી હતી.

# અશ્વેત હુમલાખોરે ફેસબુક લાઈવ કરીને ફાયરિંગ કરતા બેનાં મોત

ફરાર આરોપીની ઓળખ એઝેકીલ કેલી તરીકે થઈ

ટેનેસી

અમેરિકાના ટેનેસી રાજ્યના મેક્સિસ શહેરમાં ૧૮ વર્ષીય અશ્વેત શંકાસ્પદ વ્યક્તિએ બુધવારે સાંજે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને તેનું ફેસબુક પર લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા હતા. પોલીસે આ અંગેની માહિતી આપી છે. ફરાર આરોપીની ઓળખ એઝેકીલ કેલી તરીકે થઈ છે. મેક્સિસ પોલીસ વિભાગે ટૂટીટ કર્યું કે, અમે એક અશ્વેત વ્યક્તિને શોધી રહ્યા છે જે અનેક શૂટિંગ

માટે જવાબદાર છે. અમને રિપોર્ટ મળી રહી છે કે, તે ફેસબુક પર તે ઘટનાને રેકોર્ડ કરી રહ્યો છે પરંતુ અમારી પાસે સૂચના નથી કે, તે હાલમાં કયા વિશિષ્ટ સ્થળ પર છે. પોલીસે નાગરિકોને ઘરની અંદર જ રહેવાનો આગ્રહ કર્યો છે. પોલીસે કહ્યું કે, શંકાસ્પદ આરોપી હજુ પણ ફરાર છે. જો તમારે જરૂરી કામથી બહાર જવાનું ન હોય તો જ્યાં સુધી આ ઘટનાનું સમાધાન ન થઈ જાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. પોલીસે કિશોરીની તસવીર સાથે તે જે વાહન ચલાવતો હતો તેની વિગતો જાહેર કરી છે.

# યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ભારતીય મૂળના અરુણ સુબ્રમણ્યમની પસંદગી

વોશિંગ્ટન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય-અમેરિકન વકીલ અરુણ સુબ્રમણ્યમને ન્યૂયોર્કના જિલ્લા ન્યાયાધીશ તરીકે નામાંકિત કર્યા છે. વ્હાઈટ હાઉસ દ્વારા આ સંબંધમાં કાયદાકીય દસ્તાવેજો સેનેટને મોકલ્યા છે. જો સુબ્રમણ્યમના નામને સેનેટની મંજૂરી મળી જશે. તો તે ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેવા આપનારા પ્રથમ દક્ષિણ એશિયાના ન્યાયાધીશ હશે. હાલમાં, સુબ્રમણ્યમ ન્યૂયોર્કમાં સુસ્માન ગોડકે એલએલપીમાં ભાગીદાર છે. અહીં તેઓ 2007 થી કામ કરી રહ્યા છે, સુબ્રમણ્યમ 2006 થી 2007 સુધી યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રૂથ બેડર ગિન્સબર્ગ માટે ક્લાક તરીકે કામ કર્યું હતું.

# હીરાની નિલામી ઓક્ટોબરમાં હોંગકોંગ ખાતે યોજાશે મુલ્યવાન ગુલાબી હીરાની હરાજી થશે રૂપિયા 166 કરોડ વેચાય તેવી શક્યતા

હોંગકોંગ

ભાગ્યે જ જોવા મળતા એક ગુલાબી કલરના હીરાની નિલામી હોંગકોંગ ખાતે ઓક્ટોબર મહિનામાં યોજાવાની છે. આ નિલામી ઓકશન હાઉસ સોથથી દ્વારા કરવામાં આવી રહી છે અને એવી આશા છે કે તેની કિંમત લગભગ 2.1 કરોડ ડોલર કે ૩.166 કરોડ જેટલી આંકવામાં આવે. વિશ્વમાં ગુલાબી કે પિંક ડાયમંડ ભાગ્યે જ મળતા હોય છે. હીરાની

બજારમાં આવા કલરના હીરાને સૌથી શુદ્ધ માનવામાં આવતા હોવાથી તેની કિંમત અન્ય હીરા કરતા વધારે ઉપજે છે. જે હીરાની નિલામી થઈ રહી છે તેને વિલિયમસન પિંક સ્ટાર નામ આપવામાં આવ્યું છે. આ નામ અગાઉ મળી આવેલા બે અન્ય પિંક હીરા પાછળ રાખવામાં આવ્યું છે. 59.60 કેરેટનો એક CTF પિંક સ્ટાર હીરો હતો. વર્ષ 2017માં આ હીરો એક નિલામીમાં 7.12 કરોડ ડોલરમાં કોઈએ ખરીદ્યો હતો.

# ભારતીય મૂળના બેરિસ્ટર સુએલા બ્રેવરમેનની યુકેના ગૃહમંત્રી તરીકે નિયુક્તિ કરાયા

લંડન

દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના ફેયરહામથી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ભારતીય મૂળના બેરિસ્ટર સુએલા બ્રેવરમેનને મંગળવારે બ્રિટનના નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 42 વર્ષીય બ્રેવરમેન તેમની ભારતીય મૂળની સહકર્મી પ્રીતિ પટેલનું સ્થાન લેશે. બ્રેવરમેન અત્યાર સુધી બોરિસ જોન્સન નીત સરકારમાં અટાર્ની જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમને નવા નિયુક્ત વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે તેમને જણાવી દઈએ કે, બ્રેવરમેન બે બાળકોની માતા છે. તેઓ તમિલ ઉમા અને મૂળ ગોવાના ક્રિસ્ટી ફર્નાન્ડિઝની પુત્રી છે. તેમના માતા મોરિશસથી બ્રિટન આવ્યા હતા.





### Porcelain Tiles : Premium Quality and Best Price

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



**TILES • BACKSPLASH • LAMINATE • VINYL • HARDWOOD**

#### MONTREAL

3590, Rue Griffith, Saint Laurent,  
QC, H4T 1A7  
Phone: +1-514-260-2242 /  
+1-514-813-3850

#### OTTAWA

Unit #4+5, 200  
Colonnade Road,  
Nepean, ON, K2E 7M1  
+1-613-601-1474

#### MISSISSUAGA

5030 Maingate Drive, Unit#1,  
Mississauga, L4W 1X5  
Phone: +1 (647) 527-6030 /  
+1-514-813-3850

#### CAMBRIDGE

15 Sheldon Dr, Cambridge,  
ON N1R 6R8  
+1-647-542-1508 ,  
+1-647-527-6030

<https://clubceramic.com> Email : [sales@clubceramic.com](mailto:sales@clubceramic.com)

**MOTEL  
for  
SALE**

## NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

**Cell: 647-866-2790**

Email: [ncpancholi@gmail.com](mailto:ncpancholi@gmail.com)

Website: <https://niraj-pancholi.c21.ca/>

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience  
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...  
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

**Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011**  
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



**MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence**

**Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021**

#### COMING UP FOR SALE IN AUG/SEPT 2022

- Motel near Hamilton Under \$4M
- Franchise Hotel 3 Hrs E of GTA Under \$7M
- Franchise Hotel 1.5 Hrs E of GTA- Under \$6.5M
- Motel near Windsor Under \$6M

#### MOTEL OPERATOR / WORKING PARTNER REQUIRED

Good Salary + Partnership (20% to 50%)  
Minimum \$200,000 investment required

#### URGENT: MOTEL LISTINGS REQUIRED

Preferably Motels around \$3 Million price range & within 4 hours from GTA for some serious and qualified buyers.

#### 12 TO 45 ROOM MOTEL IN NORTHERN ONTARIO

Asking Price: \$900,000 To \$5,000,000  
(40% to 50% down payment require)

#### RECENTLY SOLD MOTELS NEAR.....

Sault Ste. Marie, Blind River, Welland, London, Sarnia, North Bay,  
Cochrane, Pembroke, Ottawa, Thunder Bay

#### JOB AVAILABLE: FOR MOTELS IN NORTHERN ONTARIO

- **Housekeeper/Cleaner** For room cleaning and general work, accommodation available for the couple / small family
- **Motel Operator** To run the motel professionally. Front desk + housekeeping work- Good salary & free accommodation.
- **Working Partner** To invest min \$200K, stay & operate/manage the motel Partnership % + Salary + accommodation.